



શ્રી શંભેશ્વર પાર્શ્વનાથાય નમઃ

શ્રાવક-શ્રાવિકાના જીવનને
માટે ઉપયોગી નિયમો સહિત

સમ્યક્ત્વ મૂલ ભારત

સમ્યક્ત્વ તથા ભારતનું વિવેચન,
તેમાં આવતા જરૂરી કેટલાક નિયમો,
ગુરુવંદન, ચૈત્યવંદનનાં સૂત્રો તથા
સવાર-સાંજનાં ઉપયોગી પરચક્ર ખાણો

વિવેચક :

ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા

પ્રકાશક :

શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ

૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે,
અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. (ગુજરાત)
ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩

	શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. (ગુજરાત) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩
	મૂલ્ય રૂ. ૨૫-૦૦
	ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (ગુજરાત) (INDIA) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩
	યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા (૩.ગુજરાત) (INDIA) ફોન : ૫૧૩૨૭
વિક્રમ સંવત ૨૦૫૮	સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧. (INDIA) ફોન : (૦૭૯) ૫૩૫૬૬૯૨
વીર સંવત ૨૦૨૮	સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૨. (INDIA) ફોન : (૦૨૨) ૨૪૦૪૭૧૭.
ઈસ્વીસન ૨૦૦૨	સુઘોષા કાર્યાલય શેખનો પાડો, ઝવેરીવાડ સામે, અમદાવાદ-૧ (INDIA) ફોન : (૦૭૯) ૨૧૩૧૪૧૮
પ્રથમ આવૃત્તિ	
	'ભરત ગ્રાફિક્સ' ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩

અમારા લખાયેલા પ્રકાશિત થયેલા પુસ્તકો

૧. **યોગવિંશિકા** :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન.
૨. **યોગશતક** :- સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન.
૩. **શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત** :- નવકારથી સામાઈયવયજુતો સુધીના સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન.
૪. **શ્રી જૈન તત્ત્વ પ્રકાશ** :- દેવસી-રાઈઅ પ્રતિકમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન.
૫. **જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ** :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોષ.
૬. **જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા** :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ.
૭. **પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક)** :- સરળ ગુજરાતી વિવેચન.
૮. **દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ)** :- સરળ ગુજરાતી વિવેચન.
૯. **તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ)** :- સરળ ગુજરાતી વિવેચન.
૧૦. **ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ)** :- સરળ ગુજરાતી વિવેચન.

૧૧. **પૂજા સંગ્રહ સાર્થ** :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે.
૧૨. **૨ નાગપૂજા સાર્થ** :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે.
૧૩. **સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઞાય** :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત્વ સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન.
૧૪. **નવસ્મરણ** :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઈંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઈંગ્લીશમાં તે ગાથાઓના અર્થ.
૧૫. **૨૮ નાકરાવતારિકા (ભાગ-૧)** :- પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨)
૧૬. **૨૮ નાકરાવતારિકા (ભાગ-૨)** :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫)
૧૭. **આઠ દૃષ્ટિની સજ્ઞાય** :- પૂ. ઉપાધ્યાય શ્રી યશો-વિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજ્ઞાયના સરળ ગુજરાતી અર્થો.
૧૮. **યોગદૃષ્ટિ સમુચ્ચય** :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન.

૧૯. પંચમ કર્મગ્રન્થ (શતક) :- ગુજરાતી સરળ વિવેચન સહ.
૨૦. તત્ત્વાર્થાધિગમ સૂત્ર :- સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત વિવેચન.
૨૧. શ્રી વાસ્તુપૂજા સાર્થ :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત પૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર.
૨૨. શ્રી સમ્યક્ ત્વ મૂલ બારવ્રત :- વિવેચન સહ.



નીચેના ગ્રન્થોના અર્થો લખવાની ભાવના છે.

૧. દ્રવ્યગુણપર્યાયનો રાસ :- પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કૃત.
૨. સમ્મતિતર્ક :- પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત.
૩. જૈન દર્શન પરિચય :- જૈન દર્શનને માન્ય તત્ત્વો, આચાર સંહિતા, આત્મવિકાસ ક્રમ, ક્ષેત્ર વિચાર આદિ વિષયોનો સુંદર પરિચય.
૪. શ્રી સવાસો ગાથાનું સ્તવન :- વિવેચન સહ.

શ્રાવક-શ્રાવિકાના જીવન માટે નિયમો જરૂરી

સંસારની ચાર ગતિમાંથી ધર્મની આરાધના કરી આત્મકલ્યાણ કરી શકીએ એવો માનવનો જ એક ભવ છે, અનંત પુણ્યાર્થએ આ ભવની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ આર્યદેશ, આર્યકુલ અને જૈનધર્મની પ્રીતિવાળા ઘરોમાં જન્મ થવો વધારે દુષ્કર છે. જન્મ થયા પછી જૈનધર્મ ગમી જવો, રૂચિ જવો તે વધારેમાં વધારે દુષ્કર છે. આપણે આ બધું પામ્યા જ છીએ, આટલી ઉચી સ્થિતિ પામીને પાપ-પુણ્યને જાણવું જોઈએ. બીનજરૂરી પાપોનો જીવનમાંથી ત્યાગ કરવો જોઈએ. જો સમજી શોચીને પાપોનો ત્યાગ ન કર્યો હોય તો તે પાપોની સાથેનો સંબંધ છોડ્યો નથી તેથી પાપો ન કરવા છતાં તે પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે.

ભાડે લીધેલું ઘર હોય, અને કોઈ કારણવશાત્ બે-ચાર માસ રહેવા ન જઈએ તથા તે મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ બે-ચાર મહિને ભાડાવાળો આવે જ. અને ભાડુ આપવું જ પડે. મકાનનો વપરાશ ભલે કર્યો નથી પરંતુ સંબંધ ત્યજ્યો નથી. તેથી ભાડુ આપવું જ પડે છે, તેમ અહીં પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચક્ષ્ણાણ લઈને તેનો સંબંધ છોડ્યો ન હોય તો પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે.

એવાં કેટલાંય પાપો છે કે જે શ્રાવક-શ્રાવિકાના જીવનમાં કરાતાં નથી. જેમકે મદિરાપાન, માંસભક્ષણ, શિકાર, પરસ્ત્રીગમન વિગેરે. પરંતુ આ પાપો ન કરવાનું જો પચ્ચક્ષ્ણાણ ન લીધું હોય તો ભાડાના મકાનની જેમ આશ્રવ ચાલુ જ રહે છે. ઘણા જીવો પચ્ચક્ષ્ણાણ લેવામાં ડરતા હોય છે કે

પચ્ચક્ષ્પાણ કરીએ તો કોઈક વખત ભાંગી જાય. ભૂલ થઈ જાય. દોષ લાગી જાય. પરંતુ ભૂલ થઈ જાય તો કરેલું આ પચ્ચક્ષ્પાણ ભાંગી જતું નથી. કારણ કે પચ્ચક્ષ્પાણમાં **અન્નત્યજાભોગેણં સહસાગારેણં** વિગેરે આગારો (છુટ) છે. જે કંઈ નાની-મોટી ભૂલ થઈ તેનાથી અતિચાર (દોષ) લાગે છે. તેની આલોચના -પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા નિંદા-ગર્હા કરીને શુદ્ધિ થઈ શકે છે. પરંતુ પચ્ચક્ષ્પાણ ભાંગી જતું નથી.

“પચ્ચક્ષ્પાણ કરવું” એ એક બંધન છે. એમ સમજી કેટલાક લોકો ડરતા હોય છે. પરંતુ ઉત્તમ અને નિર્ભય જીવન જીવવા માટે પચ્ચક્ષ્પાણ કરવું અત્યન્ત જરૂરી છે. કેટલાંક બંધનોથી જીવન નિર્ભય બને છે. જેમ કે વેચાણ લીધેલા મકાનના પૈસા આપી દીધા હોય અને સ્ટેમ્પ-સિક્કાની (દસ્તાવેજ વિગેરેની) કાર્યવાહી ન કરી હોય તો ભય ઉભો જ રહે છે તેથી સ્ટેમ્પ-સિક્કા (દસ્તાવેજ) વિગેરે કરાવવા જ પડે છે તેમ અહીં શ્રાવક અને શ્રાવિકાનું ઉત્તમ જીવન અને નિર્ભય જીવન જીવવું હોય તો સમ્યક્ત્વપૂર્વક શ્રાવક ધર્મનાં બાર પ્રતો સમજવાં જોઈએ અને ઉચ્ચરવાં જોઈએ. બાર પ્રતોના નિયમથી જીવનને દેશવિરતિધર બનાવવું એ જ સંસાર તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેથી સમ્યક્ત્વ અને બારપ્રતોને સમજાવતી આ નાની પુસ્તિકા બનાવી છે. ભગવાનના ચતુર્વિધ સંઘમાં શ્રાવક-શ્રાવિકા તરીકે આપણું સ્થાન આવે માટે અવશ્ય પ્રતધારી થવું. પરંતુ હરાયા ઢોરની જેમ રખડું અને રેઢીયાળ નિયમન વિનાનું જીવન સંસારથી તારનાર પણ નથી અને શોભાસ્પદ પણ નથી. માટે ચાલો આપણે સમ્યક્ત્વ અને બાર પ્રતો વિષે કેટલીક વાતો સમજીએ.

મૂલભૂત સમ્યક્ત્વ પ્રત

(૧) સુદેવ સુગુરુ અને સુધર્મને જ માનીશ. પરંતુ કુદેવ-કુગુરુ અને કુધર્મને માનીશ નહીં.

(૨) જે રાગ-દ્વેષાદિ મોહના સર્વભાવો ત્યજીને વીતરાગ-સર્વજ્ઞ કેવલી બન્યા છે. તેવા તથા ૧૮ દૂષણો રહિત દેવને જ સુદેવ તરીકે માનીશ. જે દેવો સ્ત્રીવાળા છે શસ્ત્રો વાળા છે. મોહવાળા છે. વિકાર વાસનાથી ઘેરાયેલા છે. તેવા ધર્મના નાયક થઈને બેઠેલા દેવોને **પરમાત્મા** (દેવ) તરીકે હું સ્વીકારીશ નહીં.

(૩) વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલનારા, સંસારના સર્વથા ત્યાગી, પાંચ મહાપ્રત પાળનારા અને પળાવનારા એવા સાધુ-સાધ્વીજીના વેશમાં વર્તનારા ગુરુને જ સુગુરુ માનીશ. તેમને જ નમન-વંદન કરીશ. પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા, સંસારના ભોગી, જુદાજુદા મત અને મઠને સ્થાપનારા, કેવળ એકલા વ્યવહારને જ અથવા એકલા નિશ્ચયને જ સ્થાપીને બીજા નયને ઉડાડી ભોળા લોકોને અવળે માર્ગે દોરનારાને હું ગુરુ તરીકે સ્વીકારીશ નહીં. તેમને નમન-વંદનાદિ વ્યવહાર કરીશ નહીં.

(૪) તીર્થંકર દેવોએ બતાવેલ અને મોહને નાશ કરનારા એવા જ્ઞાનને અને મોહનો નાશ કરે એવી ક્રિયાને જ હું

“સુધર્મ” તરીકે સ્વીકારીશ. તેના વિના અન્ય કોઈ પણ પ્રકારના જ્ઞાનને અને આચરણને હું સુધર્મ તરીકે નહીં સ્વીકારું. આ પ્રમાણે સુદેવ સુગુરુ અને સુધર્મને યાવજજીવ સ્વીકારીને તેને જ નમન-વંદન-પૂજન કરીશ. આ સમ્યક્ત્વવ્રત જાણવું. તે વ્રતમાં નીચેના નિયમ યથાશક્તિ પાળીશ. જે જે પાળી શકાય એવા નિયમો છે તેને આવી નિશાની કરવી અને જે નિયમો ન પાળી શકાય તેવા છે ત્યાં આવી નિશાની કરવી.

દર્શનાચાર :-

૧. હું દરરોજ દેરાસર જઈને ભગવાનનાં દર્શન કરીશ. દેરાસર બહુ દૂર હોય તો ઘરમાં પધરાવેલા ભગવાનનાં પણ દર્શન કરીશ.
૨. હું દરરોજ પરમાત્માની પૂજા કરીશ. (અષ્ટપ્રકારી અથવા યથાયોગ્ય)
૩. પરમાત્માની ભક્તિ નિમિત્તે ભંડારમાંરૂપીયા મુકીશ. ચોખાનો સાથીયો કરીશ, નવાં નવાં ફળ નૈવેદ્ય ધરીશ. તથા અવસરે અવસરે અંગલુછણાં ધૂપ-દીપ વિગેરે સામગ્રી દેરાસરમાં આપીશ.
૪. આઠ પડવાળો મુખકોશ બાંધીને પૂજા કરીશ. રૂમાલ વાપરીશ નહીં.
૫. ધોતી અને ખેસ પહેરીને પૂજા કરીશ. સ્ત્રીઓએ યથોચિત વેશ સમજી લેવો (ધારી લેવો)
૬. દેરાસરમાં સંસારી વાતો કરવાની, ખાવા-પીવાની,

થુંકવાની, લઘુનીતિ^૧-વડીનીતિ^૨ કરવાની વિગેરે આશાતનાઓ કરીશ નહીં.

૭. વર્ષમાં.....સ્નાત્રપૂજા અવશ્ય ભણાવીશ અને એકાદ વખત પંચકલ્યાણકાદિની મોટી પૂજા પણ ભણાવીશ.
૮. અવસરે ગામના બધા જ દેરાસરોની ચૈત્યપરિપાટી કરીશ તથા અવસરે ત્રિગુણું અને ભંડાર જેવી મોટી વસ્તુ મૂકવાનો લાભ લઈશ. પરમાત્મા પ્રત્યે અને મંદિર પ્રત્યે પ્રેમ રાખી તેની સુરક્ષાનું પણ જરૂર ધ્યાન રાખીશ.
૯. વર્ષમાં શત્રુંજય-ગિરનાર-શંખેશ્વર-સમેતશિખર આબુ આદિ જેવાં તીર્થોમાંથી.....તીર્થોની યાત્રા કરીશ. તે તીર્થોની યાત્રા કરતાં પર્વત ઉપર ચડતાં-ઉતરતાં બૂટ-ચંપલાદિ પહેરીશ નહીં. થુંકીશ નહીં. ઝાડો-પેશાબ કરીશ નહીં. રેડીયો, ટેપ વિગેરે રાખીશ નહીં. અર્થાત્ તીર્થની આશાતના થાય તેવું અનુચિત કાર્ય કરીશ નહીં.
૧૦. જીવનમાં એકાદ વખત છ'રી પાલિત સંઘમાં જઈશ. જો આર્થિક સંજોગો સારા હશે તો છ'રિ પાલિત સંઘ કાઢીશ. સમ્યક્ત્વવ્રતની ભાવના વધે તેમ વર્તીશ.
૧૧. તીર્થસ્થાનમાં રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન કે અનંતકાય ભોજન કરીશ નહિ. હાંટલનો ઉપયોગ પ્રાયઃ કરીશ નહિ. શત્રુંજય પર્વત ઉપર દહીં વિગેરે ખાઈશ નહીં.

૧. બાથરૂમ જવું, ૨. ટોયલેટ જવું.

૧૧

૧૨. જીવનમાં એકાદવાર શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર-સિદ્ધયકપૂજન અને અઢ્ઢાઈ મહોત્સવ જેવા પ્રસંગો કરીશ.
૧૩. દરરોજ સવારે ઉઠતાં અને રાત્રે સૂતાં પહેલાં, ભોજન લેતાં પહેલાં બાર બાર નવકાર ગણીશ. અને કોઈપણ કામકાજ માટે ઘરથી બહાર નીકળતાં પૂર્વે સાત ભયોના નિવારણ અર્થે સાત-સાત નવકાર મંત્ર ગણીશ.
૧૪. વર્ષમાં આવતાં પર્વોને ત્યાગ-તપથી ઉજવીશ. યથાશક્તિ એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસ કરીને પરમાત્માની ભક્તિ કરવાપૂર્વક આરાધના કરીશ.
૧૫. કુલાચાર પ્રમાણે ગોત્રદેવી તથા કુળદેવીનાં દર્શન-વંદન-નમન કરવાની તથા ગોત્રજ જારવા આદિ વ્યવહારિક કાર્યની જયણા.
- (૧) જ્ઞાનપંચમી : કારતક સુદ ૫, જ્ઞાનની આરાધના.
- (૨) મૌન એકાદશી : માગશર સુદ ૧૧, મૌન પાળવું.
- (૩) પોષ દશમી : માગશર વદ ૧૦ પાર્શ્વનાથ પ્રભુનું જન્મકલ્યાણક.
- (૪) મેરૂ તેરસ : પોષ વદ ૧૩, ઋષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક.
- (૫) મહાવીર જન્મકલ્યાણક : ચૈત્ર સુદ ૧૩, મહાવીર પ્રભુનું જન્મકલ્યાણક.
- (૬) અખાત્રીજ : વૈશાખ સુદ ૩, વર્ષાતપના પારણાં.
- (૭) દીવાળી : આસો વદ ૦), મહાવીર પ્રભુ નિર્વાણ કલ્યાણક.

૧૨

- (૮) માસધર : શ્રાવણ સુદ ૪, એક માસ પછી સંવત્સરી.
- (૯) પક્ષધર : શ્રાવણ વદ ૪, પંદર દિવસ પછી સંવત્સરી.
- (૧૦) ત્રણ ચોમાસી : કારતક સુદ ૧૪, ફાગણ સુદ ૧૪ અને અષાઠ સુદ ૧૪. (સુદ ૭ થી સુદ ૧૫ સુધીની અઢ્ઢાઈ)
- (૧૧) બે ઓળી : ચૈત્ર અને આસોમાં સુદ ૭ થી ૧૫ સુધી.
- (૧૨) પર્યુષણ પર્વ : શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૧૪.
૧૫. જૈનેતર પર્વોમાં ભાગ લઈશ નહિ. તેમાં ચાલતી પ્રથા પ્રમાણે આચરણ કરીશ નહિ. હોળી, ધુળેટી, બળેવ, રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, દેવ પોઢણી અગિયારસ, દેવ ઉઠામણી અગિયારસ વિગેરે મિથ્યાત્વી પર્વોને માન્ય રાખીશ નહિ. જુગાર રમવાનું કે ભાંગ પીવા આદિનું કાર્ય કરીશ નહિ.
૧૬. મારા જીવન દરમ્યાન યથાશક્તિ પંચાચારનું પાલન કરીશ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચ આચારો યથાશક્તિ પાળીશ.
- જ્ઞાનાચાર :-**
૧. હું દરરોજ.....કલાક ધાર્મિક સૂત્રો ગોખવાનું, અર્થ ભણવાનું અથવા ધાર્મિક પુસ્તક વાંચવાનું કામ કરીશ.
૨. જ્ઞાનની આરાધના માટે દરરોજ (અથવા.....દિવસ) ૫૧ અથવા ૫ ખમાસમણ આપીશ. એટલા જ સાથીયા કરીશ.

૧૩

- અને ॐ ह्रीं नमो नाणस्स આ પદની ઓછામાં ઓછી ૧ અને વધુમાં વધુ ૨૦ સુધીની નવકારવાળી ગણીશ.
૩. શક્ય હશે ત્યાં સુધી ગુરુ ભગવંતનું વ્યાખ્યાન સાંભળવા જઈશ.
૪. જમતાં-જમતાં કે એંઠા મોઢે બોલીશ નહિ. અક્ષરો લખેલા હોય તેવી વસ્તુ ઉપર ચાલીશ નહિ. ખાઈશ નહિ, દવા વિગેરે લઈશ નહિ, છાપાં વિગેરેના કાગળો ઉપર બેસીશ નહિ. બાળીશ નહિ. તેમાં ખાવાનું લઈશ નહિ. ટોયલેટમાં કાગળનો ઉપયોગ કરીશ નહિ.
૫. જ્ઞાનનાં સાધનો જેવાં કે પેન, પેન્સિલ, ફુટપટ્ટી, સાપડો, કાગળ, પુઠાં, સલેટ, બોલપેન વિગેરેને ભાંગીશ-તોડીશ નહિ. તેનાથી કાન આદિનો મેલ કાઢીશ નહિ. તેનો છુટો ઘા કરી કોઈને મારીશ નહિ. આવી વસ્તુઓ ભણનારાઓને યથાશક્તિ આપીને જ્ઞાનની અને જ્ઞાનીની સેવા કરીશ. આવી વસ્તુઓની પ્રભાવના કરીશ.
૬. તોતડા-બોબડાની મશ્કરી-ઠઢો કરીશ નહિ, ધાર્મિક પુસ્તકોને પસ્તીમાં વેચીશ નહિ. પગ-થુંક લગાડી આશાતના કરીશ નહિ.
૭. પાઠશાળામાં, ધાર્મિક શિબિરોમાં, પુસ્તકાદિ વસાવવામાં યથાશક્તિ દ્રવ્ય ખર્ચીશ. ભણાવનાર પંડિતજી, શિક્ષક અથવા શિક્ષિકા બહેનની યથાશક્તિ સાધર્મિક ભક્તિ કરીશ.
૮. **M.C.**ના ટાઈમમાં ધાર્મિક પુસ્તકોનું કે કોઈપણ પુસ્તકોનું વાંચન નહિ કરું. જ્ઞાનનાં સાધનોનો સ્પર્શ પણ નહિ કરું.

૧૪

૯. શાસ્ત્રો લખાવવામાં, છપાવવામાં યથાશક્તિ દ્રવ્યનો વ્યય કરીશ. લખનાર-છપાવનારને સહાયક થઈશ.
૧૦. આગમોની પૂજા કરીશ. ૪૫ આગમની પૂજા ભણાવીશ. નવા બનતા અને જૂના ચાલતા જ્ઞાનભંડારોમાં સહાયક થઈશ.

ચારિત્રાચાર :-

૧. પાંચ મહાવ્રતધારી પૂજ્ય સાધુ-સાધ્વીજીને દરરોજ વંદન કરીશ. (ગુરુ ભગવંત ન હોય તો ફોટાને પણ વંદન કરીશ.) તેમને ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ વહોરાવીશ. તેમની શારીરિક સેવા-ભક્તિ કરવા દ્વારા વૈયાવચ્ચ કરીશ.
૨. વર્ષમાં એક વખત પણ ઉપકારી ગુરુજીનાં દર્શન કરવા તે જ્યાં હશે ત્યાં જઈશ. આશાતના વાળું કાર્ય વર્જી દઈશ. ત્યાગી સાધુ-સાધ્વીજી મહારાજશ્રી પ્રત્યે હૈયાનું બહુમાન-પ્રેમભાવ રાખીશ.
૩. માત-પિતા આદિ વડિલ વર્ગને પગે લાગીશ. તેમની આજ્ઞા પાળીશ. તેમનો અવિનય-અવિવેક નહિ કરું.
૪. “સાધુ જીવન દરરોજ યાદ આવે” એટલા માટે ઘરમાં ઓઘો-પાત્રાં વિગેરે સાધુવેશ વસાવીશ. જીવનમાં ચારિત્ર આવે એટલા માટે ॐ ह्रीं नमो चारित्तस्स આ પદની ૧ થી ૨૦ સુધીની નવકારવાળી ગણીશ. દીક્ષા ન લઉં ત્યાં સુધી.....(કોઈપણ એક ચીજ)નો ત્યાગ રાખીશ.

૧૫

૫. શક્ય બનશે તો સ્વદ્રવ્યથી ઉપાશ્રય બનાવીશ. અથવા બંધાતામાં સહાયક થઈશ.
૬. અન્ય કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હશે તો તેમાં પ્રેરક થઈશ, પરંતુ અંતરાય નહિ કરું. હું પોતે સદાચારી જીવન જીવીશ પરંતુ વ્યસનોવાળું અને વ્યભિચારાદિ દોષવાળું જીવન ત્યજી દઈશ.
૭. ધરના સભ્યોને (બાળકો આદિને) ધર્મના સંસ્કાર આપીશ. પાઠશાળામાં ભણવા જવાનું, દેરાસરે દર્શન-વંદન-પૂજન કરવાનું, સાધુ-સાધ્વીજીનાં દર્શન-સેવા-ભક્તિ કરવા-કરાવવાનું શીખવાડીશ. સૂત્ર-પાઠાદિ કરાવીશ.

તપાચાર :-

તપાચાર = યથાશક્તિ તપનું આચરણ કરવું.

સંસારના સુખોનો રાગ ઓછો કરવા યથાશક્તિ બાહ્યતપ અને અભ્યન્તર તપ હું કરીશ. તેમાં નીચેના નિયમો પાળીશ.

૧. દરરોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચક્રપાણ અવશ્ય કરીશ. (જ્યારે શક્ય નહિ જ હોય ત્યારે છેવટે મુકસીનું પચ્ચક્રપાણ તો અવશ્ય કરીશ.)
૨. દિવસમાં જમવા સિવાયના સમયમાં પણ મુકસીનું પચ્ચક્રપાણ રાખીશ.

૧૬

૩. મહિનાની.....તિથિઓમાં ઉપવાસ, આયંબિલ, એકાસણું અને બેસણું કરીશ.
૪. મારા જીવન દરમ્યાન વર્ષિતપ, વીશસ્થાનકતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ધમાન તપ ઇત્યાદિ યથાશક્તિ કરીશ.
૫. ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરીશ. આ માળા જ્યાં સુધી ન પહેરાય ત્યાં સુધી.....વિગઈનો ત્યાગ કરીશ.
૬. સંવચ્છરી આદિના દંડરૂપે ત્રણ ઉપવાસો આદિ પૂરા ન થાય ત્યાં સુધી.....વિગઈનો ત્યાગ કરીશ.
૭. દર બેસતા મહિને આયંબીલ (.....) કરીશ.
૮. મારા જન્મ દિવસ નિમિત્તે તે દિવસે.....તપ કરીશ.
૯. ગુરુજીની પાસે ભવ આલોચના કરીશ ત્યારબાદ દરવર્ષે તે તે વર્ષના પાપોની આલોચના લઈશ.
૧૦. પૂર્વે બાંધેલાં કર્મોના ક્ષય નિમિત્તે યથોચિત.....લોગસ્સનો કાઉસ્સગ્ગ કરીશ. (છેવટે ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ તો અવશ્ય કરીશ જ.)
૧૧. ગુરુજી આદિ વડીલોનો વિનય કરીશ.
૧૨. ભોજન કરવાના દરેક સમયે ભૂખ કરતાં કંઈક ન્યૂન જ ભોજન કરીશ.
૧૩. આખા દિવસમાં.....દ્રવ્યોથી વધારે દ્રવ્યો વાપરવાની વૃત્તિઓને રોકીશ. (વધારે દ્રવ્યોનો ઉપયોગ નહિ કરું.)

૧૭

૧૪. વધારે માદક રસવાળી વસ્તુઓનો ઉપયોગ નહિ કરું.
૧૫. ત્યાગી-તપસ્વી મહાત્મા પુરુષોની વૈયાવચ્ચ કરીશ.
૧૬. દરરોજ.....કલાક સ્વાધ્યાય કરીશ. નવો અભ્યાસ ભણીશ. જુના અભ્યાસને સંભાળીશ અને અધ્યાત્મ શાસ્ત્રોનું વારંવાર વાંચન કરીશ.
૧૭. જ્ઞાનપ્રસારણના કાર્યમાં યથાશક્તિ સહયોગ આપીશ.
૧૮. જો શક્યતા હશે તો મારા ગામમાં અથવા તીર્થસ્થાનમાં ઉપધાન તપ કરાવીશ.
૧૯. છ બાહ્ય અને છ અભ્યન્તર તપમાંથી યથાશક્તિ તપ અવશ્ય કરીશ, મહિનામાં.....એકાસણાં,આયંબિલઉપવાસ કરીશ.
૨૦. દરરોજ વારાફરતી ૧ લઘુ વિગઈનો (કાચી અથવા મૂલથી) ત્યાગ કરીશ. મહાવિગઈ (મધ-માંસ-મદિરા અને માખણ) જે ચાર છે તેનો જીવનભર ત્યાગ કરીશ.
૨૧. પેટ ભરીને જમવાને બદલે કંઈક ન્યૂન જમીશ. કોઈપણ એકાદ-બે મિષ્ટાન્નો જીવનભર અથવા દરરોજ (વારાફરતી) ત્યાગ રાખીશ.
૨૨. કરેલી ભૂલની માફી માગીશ. ગુરુજી જે દંડ આપશે તે સ્વીકારીશ વિનય અને વૈયાવચ્ચ કરવાપૂર્વક ધર્મશાસ્ત્રોનો સ્વાધ્યાય કરીશ. સત્સંગ રાખીશ.
૨૩. કર્મક્ષયના નિમિત્તે, આઠ લોગસ્સનો, જ્ઞાનની આરાધના નિમિત્તે પાંચ લોગસ્સનો ઇત્યાદિ વિવિધ કાઉસ્સગ્ગ કરીશ.

૧૮

આ તપાચારના છ બાહ્યતપ અને છ અભ્યંતર તપમાં જે જે દોષ લગાડીએ તે તે ૧૨ અતિચાર દોષો જાણવા.

વીર્યાચાર :-

મારા આત્મામાં પ્રગટ થયેલી શારીરિક શક્તિનો (વીર્યનો) ધર્મ કાર્યોમાં ઉપયોગ કરવામાં આળસ-પ્રમાદ કરીશ નહિ. સામાયિકમાં લેવાતાં ખમાસમણાં, બન્ને પ્રતિક્રમણની કરાતી વિધિ અને ચૈત્યવંદનનાં ખમાસમણાં વિગેરે ઉભા થઈને આપીશ. વિધિપૂર્વક કાર્ય કરીશ. આળસ કરીશ નહિ. દર્શન-વંદન-પૂજન કરવામાં જ્ઞાન ભણવા-ભણાવવામાં, સદાચારનું પાલન કરવામાં મારી છતી શક્તિ ગોપવીશ નહિ. તેના ત્રણે અતિચાર દોષો સેવીશ નહિ.

૧. મન-વચન અને કાયાના બળને ગોપવીશ નહિ.
૨. તીર્થંકર પ્રભુના કહ્યા પ્રમાણે સાવધ થઈને ધર્મકાર્યોમાં વીર્ય ફોરવીશ.
૩. યથાશક્તિ સદાચારોનું ગ્રહણ અને પાલન કરીશ.

સમ્યક્ત્વમાં ન સેવવા જેવા પાંચ દોષો

(૧) શંકા :- તીર્થંકર પરમાત્માનાં વચનોમાં કોઈપણ જાતનો સંદેહ કરવો તે શંકા નામનો દોષ. ભણવા માટે, વધારે સૂક્ષ્મ તત્ત્વ જાણવા માટે વિનયપૂર્વક ગુરુજીને પૂછવાની છૂટ. પરંતુ આમ તે કંઈ હોતુ હશે ? આ બરાબર નથી. એવા અશ્રદ્ધાના ભાવે શંકા કરવી તે દોષ.

(૨) આકાંક્ષા :- તીર્થંકર પરમાત્માના શાસન વિના બીજે સ્થળે મેલી વિદ્યા આદિના કારણે અથવા મંત્ર-તંત્રથી કોઈ ચમત્કારો દેખાય, અથવા ઉપર છલ્લુ કંઈપણ સારું દેખાય, તેથી તેમાં અંજાઈ જવું. તે મતની (ધર્મની) ઈચ્છા કરવી તે આકાંક્ષા દોષ.

(૩) વિચિકિત્સા : જૈન ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં ફળ મળશે કે નહિ મળે ? એવો મનમાં સંદેહ કરવો તે તથા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનાં વસ્ત્ર-પાત્ર વગેરે મેલાં હોય, થુંક વિગેરેમાં જીવોત્પત્તિ ન થાય એટલા માટે કુંડી વિગેરે રાખતા હોય તે દેખીને તેમના ઉપર ઘૃણા (તિરસ્કાર) કરવો તે વિચિકિત્સા દોષ.

(૪) મિથ્યાદૃષ્ટિની ગુણસ્તુતિ : મિથ્યાદૃષ્ટિ આત્માઓમાં ૧ દાન, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. લોકસેવા, ૫. ત્યાગ-તપ ઈત્યાદિ ગુણો દેખાય તો પણ સભા સમક્ષ કે એવા પ્રકારના જાહેર સ્થાનોમાં તે ગુણોની પ્રશંસા કરવી તે

ચોથો મિથ્યાદૃષ્ટિની ગુણસ્તુતિ નામનો દોષ. તેમ કરવાથી તેના પક્ષને ટેકો મળે. તે જીવ મિથ્યાત્વમાં વધારે દૃઢ થાય.

(૫) મિથ્યાદૃષ્ટિનો પરિચય : અન્ય ધર્મોના પાડોશમાં વસવું, તેઓનો વધારે પરિચય કરવો, તેઓની સાથે મિત્રતા કરવી, તેઓની સાથે બેસવું, ઉઠવું. વિગેરે મિથ્યાદૃષ્ટિ પરિચય નામનો પાંચમો દોષ. આવો દોષ સેવવાથી આવેલું સમ્યક્ત્વ ચાલ્યું જાય.

આ પાંચ દોષો ત્યજી દેવા. સેવવા નહિ. અને નીચે લખેલાં પાંચ લક્ષણો (પાંચ ગુણો) અવશ્ય આદરવા.

સમ્યક્ત્વના પાંચ ગુણો

૧. ક્રોધ અને માનાદિના ગમે તેવા પ્રસંગો આવે તો પણ તેને દબાવીને સમતાભાવ (સ્થિરતાભાવ) રાખવો તે પ્રશમગુણ.

(૨) મોક્ષમાં દુઃખ વિનાનું, આત્માના ગુણોની રમણતાનું સહજ સુખ છે. એમ સમજી તેની અતિશય ઈચ્છા કરવી તે સંવેગગુણ.

(૩) સંસાર એ દુઃખોની ખાણ જ છે. એમ સમજી તેમાંથી નીકળવાની તીવ્ર ઈચ્છાપૂર્વક બંધનોથી અને કષાયોથી ભરેલાં એવાં સંસારનાં સુખો ઉપર તિરસ્કારનો ભાવ, કંટાળો, ઉદ્વેગ, ક્યારે છૂટું તેવી ઈચ્છા તે નિર્વેદગુણ.

(૪) દુઃખી, દીન, દરિદ્રી અને રોગપીડિત આદિ જીવો પ્રત્યે તેનાં દુઃખો દૂર કરવાની ઈચ્છા કરવી અને તે

દુઃખો દૂર કરવા યથાશક્તિ પ્રયત્નો કરવા તે દ્રવ્યદયા અને ધર્મ ન પામેલા જીવો પ્રત્યે ધર્મ પમાડવાની ઈચ્છા કરવી અને તેવા પ્રયત્નો કરવા તે ભાવદયા, એમ દ્રવ્યદયા તથા ભાવદયા એ અનુકંપાગુણ.

(૫) સર્વજ્ઞ કેવલી અને વીતરાગ એવા તીર્થંકર પરમાત્માએ જે કંઈ શાસ્ત્રોમાં કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે. એવો દૃઢ નિશ્ચય. અત્યન્ત વિશ્વાસ તે આસ્તિકતા ગુણ.

આ પાંચ ગુણો (લક્ષણો) યથાશક્તિ પાળવાં.

સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત

સ્થૂલ = મોટી-મોટી, પ્રાણાતિપાત = હિંસાનો, વિરમણ = ત્યાગ એવું, વ્રત = નિયમ.

કોઈપણ જાતના અનિવાર્ય પ્રયોજન વિના નિરપરાધી એવા હાલતા ચાલતા (ત્રસ) જીવોને મહારે, જાણી બૂઝીને મારવા નહિ, હણવા નહિ, આવો જે જીવનભરનો નિયમ તે પહેલું વ્રત કહેવાય છે.

ઘર બંધાવવું, પાયો ખોદાવવો, ખેતી કરતા હોઈએ તો ખેતર ખેડવું, ઈત્યાદિ અનિવાર્ય કાર્ય કરવામાં થતી હિંસાની જયણા (છુટ)

કોઈ નોકરે, ઘરના કોઈ સભ્યે કે દુકાનની કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય વિગેરે અપરાધ (ગુનો) કર્યો હોય તો તેવા દોષથી તેને બચાવવા માટે ઠપકો આપવો પડે અથવા અલ્પ તાડન કરવું પડે તેની જયણા.

સંસારનું રોજિંદું કાર્ય કરવામાં પૃથ્વીકાય-અપૂકાય વિગેરે પાંચ પ્રકારના સ્થાવર જીવો હણાઈ જાય છે તેની જયણા. છતાં શક્ય હોય તેટલી હિંસામાં અલ્પતા કરવી.

આ વ્રત પાળવામાં નીચેના નિયમો ધ્યાનમાં રાખવા. જે પાળી શકાય ત્યાં નિશાની કરવી. ન જ પાળી શકાય ત્યાં ચોકડી કરવી.

૧. પશુ-પક્ષી-મનુષ્યની હત્યા (ખૂન) કરીશ નહિ, તેઓને ચપ્પુ, લાકડી, પત્થર, વેલાણ આદિથી મારીશ નહિ, નોકર-ચાકરને પણ મારીશ નહિ.

૨૩

૨. ગર્ભપાત કરીશ નહિ-કરાવીશ નહિ, કરતાને સારા માનીશ નહિ.
૩. કીડી-મંકોડા-ઉંદર કે સર્પના દર (માટીમાં ઉંડાં પોલાણ)ને પુરીશ નહિ. તેમાં ગરમ પાણી-તેલ વિગેરે નાખીશ નહિ.
૪. પશુ-પંખીને પાળીશ નહિ. પરસ્પર લડાવીશ નહિ. પાંજરામાં પૂરીશ નહિ. કાયમાં માછલી ઘર બનાવીશ નહિ.
૫. નોકર-ચાકરને તથા આપણા આશ્રયે જીવનારાને ભૂખ્યા-તરસ્યા રાખીશ નહિ. તેઓ પાસે નિયત કરેલા કામથી વધારે કામ (વેતન-પગાર આપ્યા વિના) કરાવીશ નહિ.
૬. મચ્છર, માંકડ, માખી, જૂ, ઉંદર, કીડી, મંકોડા, વાંદા વિગેરે જીવોના ઉપદ્રવો દૂર કરવા ડી. ડી. ટી. છંટાવીશ નહિ, તેઓની હિંસા કરીશ નહિ. આવા જીવોની ઉત્પત્તિ જ ન થાય તે માટે ઘર સ્વચ્છ જ રાખીશ.
૭. અનાજ સાફ કરતાં, શાકભાજી સમારતાં, ઘર દુકાન ફેક્ટરી આદિની સફાઈ કરતાં ત્રસજીવો ન મરે તેની પૂરતી કાળજી રાખીશ.
૮. જોયા વિના અને વીણ્યા વિના અનાજ દળાવીશ નહિ, ગેસ-ચૂલા જોયા-પૂંજ્યા વિના સળગાવીશ નહિ, ઝાડ-પાન કાપીશ નહિ અને કપાવીશ નહિ. વનસ્પતિ ઉપર ચાલીશ નહિ.
૯. રસોડામાં પૂંજણીનો ઉપયોગ કરીશ અને ઘરમાં કોમળ સાવરણીનો ઉપયોગ કરીશ. કંપાઉન્ડમાં લોન ઉગાડીશ નહિ. પરમાત્માની પૂજા આદિ ઉત્તમ કાર્ય વિના ફૂલ તોડીશ નહિ અને પૂજા માટે પણ વિવેક અને જયશાપૂર્વક ફૂલ લાવીશ. ફૂલની વેણીનો ઉપયોગ કરીશ નહિ.

૨૪

૧૦. ફીઝનું, બરફવાળું અને અળગણ પાણી વાપરીશ નહિ. અળગણ પાણીથી સ્નાન કરીશ નહિ. ફૂવારાથી સ્નાન કરીશ નહિ. ડોલમાં પરિમિત પાણી લઈને સ્નાન કરીશ. પાણી પીને એંઠો ગ્લાસ માટલામાં નાખીશ નહિ. ગ્લાસ કપડાથી લુંછીશ.
૧૧. નદી-તળાવ-કુવા-સરોવર અને સમુદ્ર જેવા અતિશય પાણી (બહોળા પાણી)વાળા સ્થાનોમાં સ્નાન કરીશ નહિ. તેમાં કપડાં ધોઈશ નહિ. પરંતુ પરિમિત અને ગળેલા પાણીથી કપડાં ધોઈશ અને ધોવડાવીશ. પાંચ તિથિએ અને પર્વતિથિએ કપડાં ધોઈશ નહિ.
૧૨. ભોજન-પાણીનાં, દૂધ-દહીં-ધી-તેલનાં વાસણો ઉઘાડાં રાખીશ નહિ. એક થાળીમાં કોઈની સાથે જમીશ નહિ. એટું મૂકીશ નહિ અને થાળી ધોઈને પી જઈશ.
૧૩. શક્ય હશે તો દરરોજ અથવા ૫/૧૦/૧૨ તિથિએ અથવા પર્યુષણ, ઓળી જેવા પર્વદિવસોમાં અને તીર્થ સ્થાનોમાં ઉકાળેલું પાણી પીઈશ.
૧૪. જરૂરિયાત વિના પાણીના નળ ખુલ્લા રાખીશ નહિ. અપ્કાયની હિંસા થાય છે એમ સમજી ધીની જેમ તેનો ઉપયોગ કરીશ. પાણી ઉપર કે લીલકુલ ઉપર ચાલીશ નહિ. શક્ય બનશે તો જંગલમાં (ખુલ્લી જગ્યામાં) ટોયલેટ કરીશ.
૧૫. ઘરમાં ઠંડીથી બચવા તાપણું કે હીટરનો ઉપયોગ કરીશ નહિ. (પરંતુ ઠંડીને રોકવા વધારે કપડાં પહેરીશ અને ઓઢીશ) તથા ગરમીથી બચવા પંખો કે એરકંડીશન વાપરીશ નહિ.

૧૬. ઉક્તાં-બેસતાં અને ચાલતાં નીચે જોઈને જીવહિંસા ન થાય તેમ કાર્યો કરીશ. બોલતાં વાઉકાયની હિંસા ન થાય માટે મુખ ઉપર મુહપત્તિ અથવા રૂમાલ રાખીશ.

ઉપર મુજબના યથાશક્તિ નિયમ પાળીશ તથા નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ. બહુ જ વિવેકવાળું જીવન જીવીશ.

ન સેવવા જેવા પ્રથમ વ્રતના પાંચ અતિચારો (દોષો)

૧. વધ : કોઈપણ જીવને હણવો-મારવો.
૨. બંધ : સાંકળ, દોરી અને પાંજરા આદિથી કોઈપણ જીવને બંધનમાં રાખવો.
૩. છવિચ્છેદ : કાન-નાક વિંધવાં, ચામડીનો છેદ કરવો, ડામ દેવા વિગેરે.
૪. અતિભારારોપણ : બળદ, પાડા, ઊંટ વિગેરે પશુઓ અને મજૂરી કરતા મનુષ્યો સુખે-સુખે જેટલું ઉંચકી શકે તેનાથી વધારે ભાર તેના ઉપર મૂકવો. બુદ્ધિજીવી માણસો પાસે નિયત કરેલા કામથી વધારે કામ લેવું.
૫. ભક્તપાનવ્યુચ્છેદ : નોકર-ચાકર અથવા આપણા આશ્રિત જીવોને ભોજન-પાણીનો વિરહ કરવો. સમયસર ભોજન ન આપવું.

આવા પ્રકારના પાંચ અતિચારો (દોષો) વિના અને ઉપરોક્ત ૧૬ નિયમો યથાશક્તિ પાળવાપૂર્વક સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું પહેલું વ્રત હું પાળીશ.

૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત

સ્થૂલ=મોટું-મોટું, મૃષાવાદ=જૂઠું બોલવાનો, વિરમણ=ત્યાગ એવું, વ્રત=નિયમ.

જે જૂઠું બોલવાથી હું જૂઠાબોલો કહેવાઉં, લોકો વિશ્વાસ ન કરે, ઈજાત-આબરું નાશ પામે, ફોજદારી ગુન્હો લાગુ પડે એવું (મોટું) જૂઠું હું બોલીશ નહિ. આ બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કહેવાય છે.

ધંધાકીય સામાન્ય જૂઠું, આનંદ-પ્રમોદમાં સામાન્ય જૂઠું, લેવડ-દેવડમાં, માયા-કપટાદિ દોષોની અપેક્ષા વિના વ્યવહારથી નિર્દોષ લાગતું એવું જૂઠું બોલાઈ જાય તો તેની જયણા. આ વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ અવશ્ય પાળવા. જે પાળી શકાય તેમ હોય ત્યાં અને ન પાળી શકાય તેમ હોય ત્યાં આવી નિશાની કરવી.

૧. ઘર-જમીન, દુકાન, સ્થાવર મિલકત, સોનું, રૂપું, હીરા આદિ ઝવેરાત, સંબંધી લેવડ-દેવડ અને સંગ્રહ આદિમાં જૂઠું બોલીશ નહિ.
૨. વકીલાતનો ધંધો કરીશ નહિ. કોર્ટોમાં ખોટી સાક્ષી ભરીશ નહિ. દસ્તાવેજ આદિ ખોટા કાગળો લખીશ નહિ. કોઈને ખોટી શિખામણ આપીશ નહિ. ખોટા લેખ લખીશ નહિ. ખોટા કેસ કરીશ નહિ.
૩. લગ્ન જોડવામાં ઉંમર-અભ્યાસ આદિ સંબંધી જૂઠું બોલીશ નહિ. કોઈનો પણ વિશ્વાસઘાત કરીશ નહિ. કોઈએ મહારે ત્યાં જમા મૂકેલી થાપણ ઓળવીશ નહિ.

૪. કોઈના પણ ઉપર ખોટા આક્ષેપો-કલંકો આપીશ નહિ. કોઈને પણ ગાળો કે અસભ્ય વચનો બોલીશ નહિ.
૫. પશુ-પક્ષી સંબંધી લે-વેચમાં જૂઠું બોલીશ નહિ. કોઈએ વિશ્વાસથી મને કહેલી ગુપ્તવાત બહાર પ્રકાશિત કરીશ નહિ. આવેશમાં આવીને કોઈને પણ દુઃખ થાય તેવું બોલીશ નહિ.

ઉપરોક્ત નિયમો યથાશક્તિ સાચવીને હું બીજું વ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ.

ન સેવવા યોગ્ય બીજા વ્રતના પાંચ અતિચારો

૧. મિથ્યોપદેશ : ખોટો ઉપદેશ, ખોટી શિખામણ આપવી તે.
૨. રહસ્યાભ્યાખાન : કોઈ વ્યક્તિએ એકાન્તમાં કહેલી વાત પ્રસિદ્ધ કરવી તે.
૩. કૂટલેખ ક્રિયા : ખોટા લેખ, દસ્તાવેજ અને કાગળો લખવા તે.
૪. ન્યાસાપહાર : કોઈએ જમા મૂકેલી થાપણ પચાવી પાડવી તે.
૫. સાકારમન્ત્રભેદ : બીજાની ગુપ્તવાત તેના આકાર (હાવભાવ)થી જાણીને પ્રસિદ્ધ કરવી તે. પતિ-પત્ની વચ્ચેની ગુપ્ત વાતો પ્રગટ કરવી તે.

આ પાંચ દોષો લગાડીશ નહિ એવું બીજું વ્રત હું પાળીશ.

૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત

સ્થૂલ = મોટી, અદત્તાદાન = ચોરી, આખ્યા વિનાનું લેવું, વિરમણ = ત્યાગ, વ્રત = નિયમ.

બીજાની માલિકીની કોઈપણ વસ્તુ તે તે માલિકે આખ્યા વિના તેની સમ્મતિ વિના (જેનાથી હું ચોર કહેવાઉં એવી) ફોજદારી ગુન્હાને યોગ્ય વસ્તુ લઈશ નહિ. અર્થાત્ ચોર કહેવાઉં, મારી ઈજ્જત હલકી થાય, ફોજદારી ગુન્હો લાગુ પડે એવી મોટી ચોરી કરીશ નહિ. જ્યાં સારા સંબંધ હોય ત્યાં પેન કાગળ જેવી નાની વસ્તુ અને આડોશ-પાડોશના સંબંધો સારા હોય ત્યારે પાડોશીનાં વાસણ-ઘર જેવી વસ્તુઓ પ્રસંગ પૂરતી પૂછ્યા વિના પણ (જ્યાં ચોરીની બુદ્ધિ નથી ત્યાં) વાપરવાની જયણા.

આ વ્રતમાં નીચેના નિયમો યથાશક્તિ પાળવા જોઈએ. જે પાળી શકાય તેમ હોય અને પાળવાની ઈચ્છા હોય ત્યાં નિશાની કરવી. અને જે પાળી શકાય તેમ ન હોય ત્યાં આવી નિશાની કરવી.

૧. હું ધન-ધાન્ય સોનુ-રૂપુ દાગીના તથા જમીન આદિની ચોરી કરીશ નહિ. કોઈની પણ વસ્તુ સમ્મતિ વિના લઈશ નહિ.
૨. ચોરીનો માલ લઈશ નહીં. અને તેવા માલની લે-વેચ કરીશ નહિ.

૩. હું કોઈના પણ ઘરમાં તેનાં તાળાં તોડવાં, તિજોરી તોડવી-ખોલવી, કોઈપણ વસ્તુઓ ઉઠાવવી આવાં ચોરીનાં કામો કરીશ નહિ.
૪. ખોટાં તોલ-માપ રાખીશ નહિ. માલ લેવા માટે તોલમાપ અધિક વજનનાં અને માલ આપવા માટેનાં તોલમાપ ઓછા વજનનાં એમ ખોટું કરીશ નહિ.
૫. કોઈપણ માલમાં ભેળસેળ કરીશ નહિ. સારો માલ દેખાડી ખોટો માલ આપીશ નહિ તથા ઉપર સારો અને નીચે (અંદર) ખોટો માલ એમ મિશ્ર કરીને આપીશ નહિ.
૬. હું કોઈની જમા થાપણની ચોરી કરીશ નહિ તથા દાણચોરી કરીશ નહિ. રાજ્યના કાયદાઓનું ઉલ્લંઘન કરીશ નહિ.
૭. હું પોતે લાંચ-રૂથત લઈશ નહિ તથા શક્ય હશે ત્યાં સુધી લાંચ આપીશ પણ નહિ.
૮. રસ્તામાં પડેલી વસ્તુ પણ લઈશ નહિ.
૯. ટિકીટ વિના ટ્રેન-બસ વિગેરેની મુસાફરી કરીશ નહિ.
૧૦. પેન-પેન્સિલ, રબ્બર, ફુટપટ્ટી, કંપાસ, નોટબુક, ચંપલ, સ્લીપર, સેંડલ કે ટોપી જેવી સામાન્ય વસ્તુઓ પણ માલિકની સમ્મતિ વિના લઈશ નહિ. અને સાથે ભણતા કે ફરતા હોઈએ તેવા માણસોની પણ કોઈ વસ્તુ પ્રયોજનવશ લઉં તો પણ ચોરીની બુદ્ધિપૂર્વક લઈશ નહિ.
૧૧. સરકારી ખાતાની ટેક્ષ વિગેરેની ચોરી કરીશ નહિ.

ત્રીજા વ્રતના ઉપરોક્ત નિયમો હું પાળીશ. તથા હવે કહેવાતા પાંચ અતિચારો (દોષો) સેવીશ નહિ. તે પાંચ દોષો (અતિચારો) આ પ્રમાણે છે.

ન સેવવા યોગ્ય ત્રીજા વ્રતના અતિચારો

૧. સ્તેનપ્રયોગ = ચોરને ચોરીનું કાર્ય કરવામાં સહાયક થવું, મદદ કરવી તે.
૨. તદાહ્તાદાન = ચોરે લાવેલો ચોરીનો માલ લેવો તે.
૩. વિરુદ્ધરાજ્યાતિક્રમ = રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કરવું તે.
૪. હીનાધિકમાનોન્માન = દેવા-લેવાનાં તોલ-માપ જુદાં જુદાં રાખવાં તે.
૫. પ્રતિરૂપકવ્યવહાર = સારા-ખોટા માલની ભેળસેળ કરવી તે.
ઉપરોક્ત પાંચ દોષો લગાડીશ નહિ એવું ત્રીજું વ્રત પાળીશ.

૪. સ્વદારાસંતોષ વ્રત (પરદારા વિરમણ વ્રત)

સ્વ = પોતાની, દારા=સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષ)માં જ, સંતોષ=તૃપ્તિ માનવી, પર=બીજાની, દારા=પત્નીની સાથેનો વ્યવહાર, વિરમણ=ત્યાગ.

હું જીવનભર મારી પોતાની પત્નીની સાથેના જ સંસારવ્યવહારમાં સંતોષ માનીશ. (અને સ્ત્રીને આશ્રયી સ્વપુરુષમાં જ સંતોષ માનીશ) પરની પત્ની સાથે, કુમારિકા સાથે, અથવા વેશ્યા આદિ સાથે સંસારવ્યવહાર કરીશ નહીં. આવા પ્રકારનું આ યોથુ વ્રત હું પાળીશ.

(પરદારાવિરમણવ્રત અતિશય ભોગી રાજા-મહારાજાઓ અને કામાસક્ત જીવો માટે જ હોય છે. માટે તેની ચર્ચા અહીં કરી નથી.) આ વ્રત લીધા પછી હું નીચેના નિયમો પાળીશ. પળાય તેમાં અને ન પળાય તેમાં કરીને વ્રતનું પચ્ચક્ષ્માણ લેવું.

૧. હું કોઈ પણ સ્ત્રીનાં / પુરુષનાં અંગો અને ઉપાંગો કામ વિકારની બુદ્ધિપૂર્વક જોઈશ નહિ.
૨. ઉદ્ભટ વેશ પહેરીશ નહિ. જે વેશથી શરીરનાં અંગો દેખાય અને જોનારને વિકાર-વાસના થાય તેવાં અર્ધનગનાવસ્થાવાળાં અથવા અલ્પ વસ્ત્ર પહેરીશ નહિ.
૩. દિવસે બ્રહ્મચર્ય પાળીશ (મૈથુન ક્રીડા કરીશ નહિ.)
૪. હું મહિનામાં ૫-૧૦-૧૨ તિથિએ બ્રહ્મચર્ય પાળીશ.

૫. સર્વથા બ્રહ્મચર્ય વ્રત પાળવાનો નિયમ ન લઈ શકાય ત્યાં સુધી.....નો ઉપયોગ કરીશ નહિ.
૬. તીર્થસ્થાનોમાં, પર્યુષણ પર્વ તથા નવપદની ઓળી જેવા પર્વના દિવસોમાં બ્રહ્મચર્ય પાળીશ.
૭. તિર્થયોની સાથે મૈથુન સેવીશ નહિ તથા પુરુષ-પુરુષની સાથે કે સ્ત્રી-સ્ત્રીની સાથે હસ્તમૈથુન અથવા અત્યંત વિકારવાળું આલિંગન આદિ કામક્રીડા કરીશ નહિ.
૮. કુમારિકા કે વેશ્યા આદિ સ્ત્રીઓ (જો કે પરની માલિકીની સ્ત્રી નથી તો પણ તેઓ)ની સાથે સંસારવ્યવહાર કરીશ નહિ.
૯. પોતાની પત્નીમાં / પુરુષમાં પણ અત્યંત કામાસક્ત બનીશ નહિ.
૧૦. કામવાસના ઉત્તેજક ટેબ્લેટ, કેપ્સુલ વિગેરે દવાઓ અથવા એવી કોઈ ઔષધિઓ લઈશ નહિ.
૧૧. હું સ્ત્રીમિત્ર (ગર્લફ્રેન્ડ)/પુરુષમિત્ર (બોયફ્રેન્ડ) રાખીશ નહિ.
૧૨. મનમાં વિકારો પેદા થાય તેવી કામોત્તેજક વાર્તાઓ, બિભત્સ શબ્દપ્રયોગ, ચલચિત્રો જોવાં કે તેવી સેક્સની કથાઓ વાંચવાનું કે વંચાવવાનું કામ કરીશ નહિ.
૧૩. બ્લ્યુ ફીલ્મ જોવાનું, જોવડાવવાનું કે તેના પ્રોત્સાહનનું કાર્ય કરીશ નહિ.
૧૪. સ્ત્રી-પુરુષના સૌન્દર્યની, રૂપની, ટાપટીપની, વેષભૂષાની, અલંકારોની (કામોત્તેજક) વાતો કરીશ નહિ. બહુ ટીકી-ટીકીને જોઈશ નહિ.

૧૫. જવાબદારી વિનાનાં લગ્નો કે સગપણો કરીશ નહિ, કરાવીશ નહિ, તેમાં ભાગ લઈશ નહિ. પતિ-પત્નીના જોડકાની અતિશય પ્રશંસા કરીશ નહિ.
૧૬. કામવિકારની બુદ્ધિએ પરસ્ત્રીનો / પરપુરુષનો સ્પર્શ કરીશ નહિ.
૧૭. બ્રહ્મચર્યના પાલન માટે “ૐ હ્રીં નમો બંભવયધારીણં” આ પદની માળા ગણીશ તથા નેમનાથ પ્રભુના ચરિત્રનું અને શ્રી સ્થૂલિભદ્રજનું સતત સ્મરણ-મનન-ચિંતન તથા આરાધના કરીશ. તેના દ્વારા કામવાસનાને જીતીશ.
૧૮. જે આસનાદિ ઉપર પરસ્ત્રી બેઠી હોય (અથવા પરપુરુષ બેઠો હોય) તે આસન ઉપર સાથે બેસીશ નહિ.
૧૯. હું પરસ્ત્રીની સાથે સ્વસ્ત્રીની નિંદાનું કે અકુશળતાનું વર્ણન કરવાનું કામ નહિ કરું. (કે જેથી મારા તરફ પરસ્ત્રી આકર્ષાય નહિ.)
૨૦. બેડરૂમમાં સ્ત્રીનાં, અર્ધનગ્ન સ્ત્રીનાં કે કામોત્તેજક ચિત્રો રાખીશ નહિ. દિવાલે ચોંટાડીશ નહિ, તથા ગુપ્ત અંગો દેખાય તેવાં ચિત્રો રાખીશ નહિ. (સ્ત્રીને આશ્રયી પુરુષનાં ચિત્રો)
૨૧. જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય તે સ્થાને સ્ત્રી ઉઠી ગયા પછી પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને જે આસન ઉપર પુરુષ બેઠો હોય તે આસન ઉપર પુરુષ ઉઠી ગયા પછી સ્ત્રી ત્રણ પ્રહર (૯ કલાક) સુધી બેસે નહિ.

ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિયારો (દોષો) લગાડીશ નહિ.

ન સેવવા યોગ્ય ચોથા વ્રતના અતિયારો

૧. **પરવિવાહકરણ** = જવાબદારી વિનાનાં પારકાનાં લગ્નો કરાવવાં, અર્ધ લગ્નો (સગપણ) કરાવવાં.
૨. **ઙ્ઙત્વરપરિગૃહીતાગમન** = અલ્પકાળ માટે પર વડે રખાત રખાયેલી સ્ત્રીની સાથે (પરની સાથે વિવાહિત થયેલી આ પત્ની નથી એમ માનીને) મૈથુન સેવન કરવું તે. (સ્વદારાસંતોષીને આ દોષ સેવાય નહિ. આ દોષ જો સેવે તો તે અનાચાર બને છે.)
૩. **અપરિગૃહિતાગમન** = ન પરણેલી અર્થાત્ કુમારિકા સાથે અથવા વેશ્યાની સાથે વિષયસેવન કરવું તે. (આ પણ દોષ સ્વદારાસંતોષીને માટે ઉચિત નથી. અનાચારરૂપ થાય છે.)
૪. **અનંગક્રીડા** = જે અંગો કામક્રીડાનાં નથી. તે અંગોથી કામક્રીડા કરવી તે.
૫. **તીવ્રકામાભિનિવેશ** = કામવાસનાની અત્યન્ત તીવ્ર આસક્તિ રાખવી

ઉપરોક્ત અતિયારો (દોષો) લગાડ્યા વિના હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ.

૪. પરિગ્રહ પરિમાણ વ્રત

પરિગ્રહ = ધન-ધાન્યાદિ પદાર્થો તથા મૂર્છા - મમતા,

પરિમાણ = માપ ધારવું.

હું નીચે મુજબ ધન-ધાન્ય, સોનુ-રૂપુ વિગેરે વસ્તુઓ તથા મિલકત વિગેરે વસ્તુઓ ધારેલા માપથી વધારે રાખીશ નહિ.

૧. ધન = રોકડ નાણું શેરો, ફીક્સ ડીપોઝીટો વિગેરે સર્વેમાં મળીને ધન વધારેમાં વધારે.....થી વધારે રાખીશ નહિ. ખરીદ ભાવે આ માપ હું ધારું છું.
૨. ધાન્ય = ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, મગ વિગેરે સર્વે ધાન્યો મળીને હું વધારેમાં વધારે ઘરમાં..... કીલોથી અને દુકાનમાં.....કીલોથી વધારે રાખીશ નહિ.
૩. ક્ષેત્ર = ખુલ્લા પ્લોટો-જમીન અને ખેતર વિગેરે..... ફુટથી કે મીટરથી વધારે રાખીશ નહિ.
૪. વાસ્તુ = વસવાટ કરી શકાય તેવાં બાંધેલા મકાનો બંગલા-હવેલીઓ-દુકાનો-ઓફિસો વધુમાં વધુથી વધારે રાખીશ નહિ.
૫. રૂપ્ય = ચાંદીના દાગીના અથવા ચાંદી.....ગ્રામથી વધારે રાખીશ નહિ.

૩૬

૬. સુવર્ણ = સોનુ અથવા તેના દાગીના.....ગ્રામથી વધારે રાખીશ નહિ. તથા હીરા-માણેક-મોતી વગેરે બાકીનું ઝવેરાત.....રકમથી વધારે રાખીશ નહિ.
૭. કુપ્ય = ઘરની ઘર-વખરી રાયરચીલું અને ફરનીચર વિગેરે સર્વે મળીને.....રકમની કિંમતથી વધારે રાખીશ નહિ.
૮. દ્વિપદ = ઘરમાં.....અને દુકાનમાં.....થી વધારે નોકર-ચાકર રાખીશ નહિ.
૯. ચતુષ્પદ = ગાય-ભેંશ-બળદ-ગિંટ-બકરી વિગેરે ચારપગાં (ચાર પગવાળાં) પ્રાણીઓ.....થી વધારે રાખીશ નહિ.

આવા પ્રકારનું પાંચમું વ્રત હું પાળીશ. તેમાં નીચેના નિયમો પણ યથાશક્તિ પાળીશ. જે પાળી શકાય તેમ હોય ત્યાં અને ન પાળી શકાય તેમ હોય ત્યાં આવી નિશાની કરવી.

૧. ધારેલી મિલકત કરતાં વધારે આવક થાય તો સ્ત્રી-પુત્રાદિના નામે ફેરબદલી કરવા દ્વારા મારી મમતાને પોષીશ નહિ. પરંતુ ધર્મમાર્ગે ખર્ચો નાખીશ.
૨. કોઈપણ એક પરિગ્રહની ધારેલી રકમ બીજા પરિગ્રહમાં ઉમેરીશ નહિ.
૩. ભાવોની વધઘટે (હૈયામાં માયા રાખીને) ફેરફાર કરીશ નહિ.

૪. સ્કુટર, મોટર વિગેરે સાધનોની કિંમત પણ ધનના પરિગ્રહમાં ગણીશ.

૫. બાપદાદાની વારસાગત મળતી મિલ્કત માટે કે ઘરાકો પાસે લેવાની નીકળતી રકમ માટે કોર્ટનો આશ્રય લઈશ નહિ. શ્રાવકપણાને અનુચિત ક્લેશ-કંકાસ કરીશ નહિ.

ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું આ વ્રત પાળીશ. તથા તે વ્રતના નીચે મુજબ પાંચ અતિયારો સેવીશ નહિ.

ન સેવવા યોગ્ય પાંચમા વ્રતના અતિયારો

૧. ધનધાન્યપ્રમાણાતિક્રમ = ધન અને ધાન્યના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે.
૨. ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ = ખુલ્લી જમીન અને બાંધેલા મકાનોના ધારેલા નિયમોનું ઉલ્લંઘન કરવું તે.
૩. હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ = ઝવેરાતના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે.
૪. દાસીદાસપ્રમાણાતિક્રમ = નોકર-ચાકર, સ્ત્રી-પુરુષ તથા પશુના માપનું ઉલ્લંઘન કરવું તે.
૫. કુપ્યપ્રમાણાતિક્રમ = ફરનીચર તથા રાચરચીલાના માપનું ઉલ્લંઘન કરવું તે.

ઉપરોક્ત પાંચ અતિયારો વિના હું આ પાંચમું વ્રત પાળીશ.



૬. દિગ્પરિમાણ વ્રત

(પ્રથમ ગુણવ્રત)

દિગ્=દિશાનું, પરિમાણ=માપ ધારવું તે. વ્રત=નિયમ. મારા નિવાસસ્થાનથી ચારે દિશાઓમાં, ચારે વિદિશાઓમાં ઉપર અને નીચે એમ કુલ દસે દિશાઓમાં..... માઈલથી (અથવા કીલોમીટરથી) વધારે દૂર જઈશ નહિ. તેમાં યથાશક્તિ નીચેના નિયમો પાળીશ. શક્ય હોય ત્યાં અને શક્ય ન હોય ત્યાં નિશાની કરવી.

૧. એક દિશાનું માપ (ન જવાનું હોય એટલે) બીજા દિશામાં (જ્યાં જવાનું બન્યું છે ત્યાં) ઉમેરીશ નહીં.
૨. અમેરિકા-આફ્રિકા-ઈંગ્લેન્ડ, જર્મન અને જાપાન જેવા દેશોમાં જઈશ નહિ. (ભારત બહાર જઈશ નહિ) અથવા જવું જ પડે તો તે તે દેશોમાંવારથી વધારે વાર જઈશ નહિ. વિદેશોમાં જ વસતા ભાઈ-બહેનોએ પણ પોતાના નિવાસવાળા દેશ વિના બીજા દેશોમાં જવા-આવવાની ઉપર મુજબ ધારણા કરવી.
૩. જીવનમાં.....થી વધારે વાર પ્લેનમાં મુસાફરી કરીશ નહિ.
૪. જીવનમાં.....થી વધારે વાર સ્ટીમ્બર, લોંચ, હોડી અને વહાણ દ્વારા દરિયાઈ મુસાફરી કરીશ નહિ.
૫. હું ચોમાસામાં તીર્થયાત્રા વિના.....થી વધારે વાર બહારગામ જઈશ નહિ.
૬. ચોમાસામાં ભારતમાં જ રહીશ. (અથવા મારા

વસવાટવાળા દેશમાં જ રહીશ.) અને ભારતમાં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તામિલ, કર્ણાટક, આન્ધ્ર આદિ પ્રાન્તીય દેશોમાં પણ.....થી વધારે વાર જઈશ નહિ.

૭. ખાસ અનિવાર્ય કારણ વિના રાત્રે ૧૧-૧૨ વાગ્યા પછી ઘર બહાર જઈશ નહિ.
૮. પર્યુષણ જેવા મહાપર્વના દિવસોમાં વિશિષ્ટ કારણ વિના ગામ બહાર જઈશ નહિ.
૯. ધર્મનાં કાર્યો માટે અથવા જૈન શાસનની પ્રભાવના અર્થે ધારેલા દિશાના નિયમથી અધિક જવું પડે તો તેની જયણા. છઠ્ઠા પ્રતના ઉપરના નિયમો હું યથાશક્તિ પાળીશ. તથા નીચેના અતિચારો લગાડીશ નહિ.

ન સેવવા યોગ્ય છઠ્ઠા પ્રતના અતિચારો

૧. **ઉર્ધ્વદિશાવ્યતિક્રમ** = ઉપરની દિશામાં ધારેલા માપથી અધિક જવું તે.
૨. **અધોદિશાવ્યતિક્રમ** = નીચેની દિશામાં ધારેલા માપથી અધિક જવું તે.
૩. **તિર્યગ્દિશાવ્યતિક્રમ** = ચારે દિશા-વિદિશામાં ધારેલા માપથી અધિક જવું તે.
૪. **ક્ષેત્રવૃદ્ધિ** = એક દિશાનું માપ બીજી દિશામાં ઉમેરવું તે.
૫. **સ્મૃતિઅંતર્ધાન** = દિશાઓમાં જવા-આવવાનું ધારેલું માપ ભૂલી જવું તે.

ઉપરોક્ત અતિચારો (દોષો) વિનાનું આ છઠ્ઠું દિગ્પરિમાણ વ્રત હું પાળીશ.

૭. ભોગોપભોગ વિરમણ વ્રત

(બીજું ગુણવ્રત)

ભોગ=એકવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ, જેમ રાંધેલું ધાન્ય. **ઉપભોગ**=વારંવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ. જેમ કે કપડાં, દાગીના, સ્ત્રી વિગેરે. **વિરમણ**=ત્યાગ. આવશ્યકતા વિનાના ભોગ-ઉપભોગનો ત્યાગ.

હું મારા જીવનમાં ભોગની સામગ્રી.....કિંમતથી વધારે અને ઉપભોગની સામગ્રી.....કિંમતથી વધારે રાખીશ નહિ. અને આ વ્રતના અનુસંધાનમાં ઘણાં પાપ કરાવનારા એવા ૧૫ કર્માદાનના વેપારો (ધંધાઓ) શક્ય બનશે તેટલા ત્યજી દઈશ. (કરીશ નહિ), આ વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ પાળીશ. પાળી શકાય તેમાં અને ન પાળી શકાય તેમાં નિશાની કરવી.

૧. દિવસમાં ૧ વાર, ૨ વાર કે ૩ વારથી વધારે વાર ભોજન કરીશ નહિ.
૨. પ્રત્યેક ટંકના ભોજનમાં ૫/૬/૭ અથવા યથોચિત દ્રવ્યોથી વધારે પદાર્થોનું ભોજન કરીશ નહીં.
૩.જોડીથી વધારે કપડાં સ્ટોકમાં રાખીશ નહિગ્રામથી વધારે દાગીના સોનાના રાખીશ નહીં તથા ચાંદીના દાગીના.....ગ્રામથી વધારે અને અન્ય ઝવેરાતના દાગીના.....કિંમતથી વધારે રાખીશ નહિ.

૪૧

૪. દરરોજ ચૌદ નિયમો ધારીશ. સાંજે-સવારે તે નિયમો સંક્ષેપીને બીજા નિયમો ધારીશ.
૫. બીડી-સીગારેટ, તમાકુ-હોકી, ગુટકા, માવા, પાન, મસાલા, માણેકચંદ, સોપારી, ચરસ, અફીણ, બ્રાઉનસુગર વિગેરેનો ઉપયોગ કરીશ નહિ.
૬. મદિરાપાન, વેશ્યાગમન, શિકાર અને જુગારનાં પાપો કરીશ નહિ.
૭. રાંધેલું વાસી અનાજ રાખીશ નહિ, ખાઈશ નહિ, રાત્રિ-ભોજન કરીશ નહિ. (રાત્રે જમવું જ પડે, એવી આજીવિકા હોય તો રાત્રે એક વાર જમ્યા પછી નહિ જમું.)
૮. અનંતકાય (કંદમૂળ)નો સર્વથા ત્યાગ રાખીશ.
૯. અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરીશ નહિ અથવા ૧-૨-૩ વસ્તુ વિના બીજાં અભક્ષ્ય પદાર્થો ખાઈશ નહિ.
૧૦. ઈંડાં ખાઈશ નહિ, વેચીશ નહિ, ફોડીશ નહિ.
૧૧. આદ્રાં નક્ષત્ર પછી કેરીનો ત્યાગ કરીશ. કોબીજ, ફુલાવર તથા તેનાં શાક ખાઈશ નહિ.
૧૨. ચરબી અને ઈંડાના રસવાળી ચોકલેટ, કેટબરી ખાઈશ નહિ.
૧૩. કાચા દૂધ-દહીની સાથે કઠોળ કે તેની બનાવટનો ઉપયોગ કરીશ નહિ.
૧૪. હું હાંટલનું ખાઈશ નહિ. બજારનું ખાઈશ નહિ, ઉભા ઊભા ખાઈશ નહિ.

૬

૪૨

૧૫. ફર્ટીલાઈઝર દવાઓનો ઉપયોગ કરીશ નહિ. કેરોસીન, પેટ્રોલ, ડીઝલ અને ગેસ વેચવાનો ધંધો કરીશ નહિ. ચરબીવાળા સાબુ, ટૂથપેસ્ટ વિગેરેને વેચવાનો ધંધો કરીશ નહિ તથા તેવી વસ્તુઓ હું વાપરીશ નહિ.
૧૬. હું શ્રેડ, પાઉં, ટોસ, સેન્ડવીચ, પાઉંભાજી ખાઈશ નહિ.
૧૭. હું માછલાં પકડવાની જાળ વેચવાનો ધંધો કરીશ નહિ, પોપટ તથા ઉંદર આદિનાં પાંજરાં વેચવાનો ધંધો કરીશ નહિ તથા મત્સ્યોદ્યોગ કરીશ નહિ.

સાતમું વ્રત બરાબર પાળવા માટે ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ૧૪ નિયમો અને ૧૫ કર્માદાન સમજવા જરૂરી છે. તે સર્વેનું ટુંકાણમાં સ્વરૂપ આ પ્રમાણે છે :-

૨૨ અભક્ષ્ય

૧. માંસ : માંસ, ઈંડાં, માછલી, કોડલીવર ઓઈલ.
૨. મધ : માખીઓનું, ભમરાઓનું, કુત્તિયનું (એક પ્રકારનું ક્ષુદ્ર જન્તુનું) મધ,
૩. માખણ : દહીને વલોવીને કાઢેલું, (છાશમાં ડૂબેલ માખણ અભક્ષ્ય ન ગણાય.)
૪. મદિરા : દારૂ, ચરસ, ગાંજો બ્રાઉનસુગર, તમાકુ, વિગેરે.
૫. ઝેર : સોમેલ, વચ્છનાગ, હરતાલ, પોટાશીયમ, અફીણ વિ.
૬. બહુબીજ : જેનો ગર્ભભાગ (ખાદ્યભાગ) જુદો ન પડી શકે તેટલાં બધાં બીજવાળી વસ્તુ, જેમ કે ખસખસ, અંજીર, જામફળ વિગેરે.

૭. બોળો : ચાસણી, તડકા આપ્યા વિનાનાં અથાણાં, ત્રણ દિવસ પછીનાં ચાસણી વિગેરે.
૮. દ્વિદળ : કાચા દૂધ, દહીં અને છાશ સાથે કઠોળ, ગવાર, કુમટીઆ ખાવા તે.
૯. તુચ્છફળ : જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વધારે હોય તે, જેમકે ચણીબોર, પીચુ, પીલુ, ફાલસા, સીતાફળ.
૧૦. અજાણ્યાં ફળ : કોઈ ન ઓળખી શકે તેવાં અર્થાત્ અજ્ઞાત ફળ.
૧૧. રાત્રિભોજન : સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય પૂર્વે અંધકારમાં ભોજન કરવું તે.
૧૨. ચલિતરસ : જે ભોજનનાં રૂપ રસ બદલાઈ ગયાં હોય તે. ઉતરી ગયેલું ભોજન.
૧૩. કરા : ઉંબરો-કાલુંબર વિગેરે.
૧૪. પીપળો : એક પ્રકારનું વૃક્ષ, પીંપળો, વડનાં ફળ.
૧૫. માટી : કાચી માટી.
૧૬. રીંગણ : રીંગણાં તથા રીંગણાંની જાતિ.
૧૭. બરફ : બરફ, મશીનનો આઈસ, આઈસ્ક્રીમ, ગુલ્ફી વિગેરે.
૧૮. મૂળા : મૂળા તથા મૂળાની ડાંડલી-પાંદડાં વિગેરે અંગો.
૧૯. કેરી : આર્દ્રા નક્ષત્ર બેઠા પછી કેરી આમ્રફળ.
૨૦. અષાડ ચાતુર્માસ : અષાડ સુદ ૧૪ પછી પંદર દિવસથી અધિક કાળની મીઠાઈ, લોટ વિગેરે.

૨૧. કારતક ચાતુર્માસ : કારતક સુદ ૧૪ પછી એક માસથી અધિક કાળની મીઠાઈ, લોટ, ખાખરા વિગેરે.
૨૨. ફાગણ ચાતુર્માસ : ફાગણ સુદ ૧૪ પછી વીસ દિવસથી અધિક કાળની મીઠાઈ લોટ, ખાખરા વિગેરે તથા કાજુ-દ્રાક્ષાદિ મેવા વિગેરે. આ બાવીસ પદાર્થો અભક્ષ્ય (ખાવાને માટે અયોગ્ય જાણવા)

૩૨ અનંતકાય

૧. આદુ, ૨. બટાટાં, ૩. કાંઠા, ૪. લસણ, ૫. ગાજર, ૬. સૂરણ, ૭. સક્કરીયાં, ૮. રતાળુ, ૯. પીંડાળુ, ૧૦. મૂળકંદ, ૧૧. વજ્રકંદ, ૧૨. હીરલીકંદ, ૧૩. ખીરસુઆ કંદ, ૧૪. ખીલોડા, ૧૫. લોઢી, ૧૬. ગરમર, ૧૭. થેગ, ૧૮. લીલો ક્યુરો, લીલી હળદર, લીલી મોથ, લીલી ગળો, ૧૯. લુણીની છાલ, ૨૦. લુણીવાંસ, ૨૧. કારેલી, ૨૨. કુણી આંબલી, ૨૩. કુમારપાઠાં, ૨૪. થોરની જાતિ, ૨૫. શતાવરી, ૨૬. ભૂમિફોડા, ૨૭. વત્થુલાભાજી, ૨૮. પાલકભાજી, ૨૯. મુઅરવેલ, ૩૦. સેવાલ, ૩૧. કુણી વનસ્પતિ, કુણા અંકુરા અને કુણાં ફળો તથા ૩૨. કિસલય (કુપળો) વિગેરે વસ્તુઓ અનંતકાય છે.

અનંતા જીવો એક શરીરમાં જ્યાં રહે તે અનંતકાય. (આ અનંતકાયને કંદમૂળ અને સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે. તે જીવનભર ત્યજી દેવાં જોઈએ, તથા અનંત જીવો જ્યાં નથી પરંતુ ઘણા જીવોની હિંસા હોવાથી તામસી પરિણતિ થતી હોવાથી અને આરોગ્યને નુકશાનકારક હોવાથી ખાવાને માટે જે અયોગ્ય છે તે અભક્ષ્ય.) શક્ય હોય ત્યાં સુધી સર્વે અભક્ષ્ય પણ ત્યજી દેવાં જોઈએ.

૪૫

હવે ચૌદ નિયમો પ્રતિદિન ધારવાના આ પ્રમાણે છે :-

૧. સચિત્ત : જીવવાળી વસ્તુ તે સચિત્ત, હું આજે સચિત્ત વસ્તુનો સર્વથા ત્યાગ કરીશ. અથવા.....થી વધુ સચિત્ત વસ્તુ વાપરીશ નહીં.
૨. દ્રવ્ય : ખાવા લાયક પદાર્થ. હું આજે.....દ્રવ્યોથી વધારે દ્રવ્યો વાપરીશ નહીં.
૩. વિગઈ : વિકાર કરે તે. નરકાદિ ગતિમાં લઈ જાય તે વિગઈ કહેવાય. માંસ, મધ, માખણ અને મદિરા આ ચાર મહાવિગઈનો હું જીવનભર ત્યાગ કરું છું. અને ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને તળેલું. આ છ લઘુવિગઈ છે. આ છ વિગઈઓમાંથી આજે હું.....વિગઈનો ઉપયોગ કરીશ નહિ.
૪. વાણહ : ઉપાનહ : ચંપલ, બૂટ, સેંડલ, પગરખાં મોજાં વિગેરે હું આખા દિવસ દરમ્યાન (અથવા રાત્રિ દરમ્યાન).....જોડીથી વધારે ચંપલાદિનો ઉપયોગ કરીશ નહિ.
૫. તંબોલ : મુખવાસ, હું આજે.....ગ્રામથી વધારે મુખવાસ લઈશ નહિ.
૬. વસ્ત્ર : હું આજે.....જોડીથી વધારે વસ્ત્રો પહેરીશ નહિ.
૭. કુસુમ : હું આજે.....ગ્રામથી વધારે વસ્તુઓ સુંઘીશ નહિ.
૮. વાહન : હું આજે.....થી વધારે મોટર, ટ્રેન, ઘોડાગાડી કે રીક્ષા વિગેરે વાહનનો ઉપયોગ કરીશ નહિ.

૪૬

૯. શયન : હું આજે બેસવા માટે અને સુવા માટે.....થી વધારે બેઠક-શય્યાનો વપરાશ કરીશ નહિ.
૧૦. વિલેપન : શરીરે લગાડવાની વસ્તુઓ જેમ કે તેલ, પાવડર વિગેરે, હું આજે.....ગ્રામથી વધારે વસ્તુઓ વાપરીશ નહિ.
૧૧. બ્રહ્મચર્ય : હું આજે દિવસે બ્રહ્મચર્ય પાળીશ. રાત્રે પણ બ્રહ્મચર્ય પાળીશ. અથવા સ્વદારાસંતોષી થઈને રહીશ.
૧૨. દિશા : હું મારા નિવાસસ્થાનથી ચારે દિશા ચારે વિદિશા, ઉપર અને નીચે.....કિલોમીટરથી વધારે ગમનાગમન કરીશ નહિ.
૧૩. સ્નાન : હું આજે.....થી વધારે વાર સ્નાન કરીશ નહિ.
૧૪. ભોજન : ત્રણે ટંકનું મળીને કુલ આજે ભોજન હું..... કિલોથી વધારે કરીશ નહિ.
- પૃથ્વીકાય : કાયુ મીઠું, હાથ ધોવા માટેની માટી વિગેરે મળીને હું આજે.....ગ્રામથી વધારે પૃથ્વીકાયનો ઉપયોગ કરીશ નહિ.
- અધ્કાય : પીવામાં.....ગ્રામથી વધારે પાણીનો ઉપયોગ કરીશ નહિ. ન્હાવામાં.....ડોલથી વધારે પાણીનો ઉપયોગ કરીશ નહિ. કપડાં ધોવામાં તથા વાસણ માંજવામાં ઓછું પાણી વપરાય તેનો ઉપયોગ રાખીશ. નદી, તળાવ, સરોવર અને સમુદ્ર જેવા બહોળા પાણીમાં સ્નાન અને વસ્ત્ર ધોવણ કરીશ નહિ.
- તેઉકાય : આજે હું.....લાઈટ,.....ચુલા, અથવા..... ઘરની લાઈટ ચુલાથી વધારે અગ્નિનો વપરાશ કરીશ નહિ. તથા ટીવી, ફીઝ, વોર્શીંગમશીન, ઘરઘંટી, હીટર ટેપરેકર્ડ આદિમાં શક્ય બનશે તેટલી અગ્નિકાયની હિંસા ઓછી કરીશ.

વાઉકાય : હું આજે.....થી વધારે પંખા,થી વધારે હિંચકા,થી વધારે એરકંડીશનનો ઉપયોગ તથા.....થી વધારે ચાલણીનો વપરાશ કરીશ નહિ.

વનસ્પતિકાય : ફળ, ફુટ, શાક, ભાજી વિગેરે સર્વે મળીને.....કિલોથી વધારે વનસ્પતિનો ઉપયોગ કરીશ નહિ.

અસિ : છેદવાનાં સાધન જેમ કે સોય, કાતર. છરી, ચપ્પુ, શસ્ત્ર, બ્લેડ, ટાંકણી વિગેરે. આજે હું સર્વે મળીને.....થી વધારે આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ.

મસિ : લખવાનાં સાધન જેમ કે પેન, બોલપેન, પેન્સિલ, ચોક વિગેરે. આજે હું સર્વે મળીનેથી વધારે આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ.

કૃષિ : ખેતીનાં સાધનો જેમ કે હળ વિ. હું આજે ખેતીનું કાર્ય કરીશ નહીં. અથવા.....થી વધારે સાધન વાપરીશ નહિ.

ચૌદ નિયમોની સાથે પાંચ કાયની હિંસાનું પરિમાણ તથા અસિ-મસિ અને કૃષિનું માપ ધારવું જરૂરી છે. આ ચૌદ નિયમો એક દિવસ પુરતા સવારે ધારવાના, સાંજે વાપરેલી વસ્તુઓને યાદ કરી જેટલી વસ્તુ ન વાપરી હોય તેટલી વસ્તુઓ લાભમાં એમ બોલીને સંક્ષેપવું. એ જ રીતે રાત્રિના નિયમો વિષે સવારે સંક્ષેપવાનું સમજવું. એમ પ્રતિદિન આચરવું.

આ જીવમાં જેનાથી ઘણાં વધારે કર્મો બંધાય તે **કર્માદાન** એવાં ૧૫ કર્માદાન છે. તે શક્ય હોય ત્યાં સુધી જીવનભર વર્ષ દેવાં જોઈએ. અથવા ન જ વર્ષ શકાય તેવાને બકાત કરી શેષ આ કર્માદાનો ત્યજી દેવાં જોઈએ. તે આ પ્રમાણે :-

૧૫ કર્માદાનો

૧. **ઈંગાલકર્મ :** અગ્નિની ભઠ્ઠીઓ ચલાવવી પડે તેવાં લોખંડ, પીત્તળ, તાંબુ વિગેરે ધાતુઓ ઓગાળવાનો, કોલસા પાડવા, ઈંટો પકવવી, નળીયાં પકવવાં, કાચ બનાવવા ઈત્યાદિ વેપારો તે પ્રથમ કર્માદાન.
૨. **વનકર્મ :** જંગલોમાં વૃક્ષો કાપવાં, બાળવાં, લાકડાં કાપવાં-લાવવાં-વેચવાં, માળી-ખેડૂત-કઠીયારાનો ધંધો કરવો.
૩. **શકટકર્મ :** ગાડાં-બળદ-સ્કૂટર-સાઈકલ-મોટર વિગેરે વાહનો લેવાં-વેચવાં.
૪. **ભાટકર્મ :** ગાડાં, ઘોડા, ઊંટ, બળદ પાડા વિગેરે પશુઓ ભાડુ મેળવવા આપવાં અથવા તેના દ્વારા ભાડુ મેળવવાનો ધંધો કરવો. તથા મોટર, ટ્રક, ટેમ્પો વિગેરે ભાડે ફેરવવા, ભાડે આપવા વિગેરે.
૫. **સ્ફોટકર્મ :** કૂવા, વાવ, તળાવ વિગેરે ખોદવા, ખોદાવવાં, તથા ભરેલાં તળાવ વિગેરે ખાલી કરવાં-કરાવવાં આવા કાર્યો કરવાનો કોન્ટ્રાક્ટરનો ધંધો કરવો તે.
૬. **દંત વેપાર :** હાથીદાંત, શિંગડાં તથા મોતી વિગેરેનો વ્યાપાર.
૭. **લાખવેપાર :** લાખ, કુસુંબો, હડતાળ વિગેરેનો વ્યાપાર.
૮. **રસવેપાર :** ઘી, તેલ, ગોળ, દૂધ, દહીંનો વેપાર.

૯. કેશવેપાર : ઘેટાં, બકરાં, વિગેરેના વાળનો (ઉનનો) વેપાર, મોર, પોપટ વિગેરેના પીંછાનો વેપાર કરવો તે.
૧૦. વિષવેપાર : અફીણ, સોમલ, બીડી, તમાકુ, સીગારેટ, દારૂ વિગેરેના વેપારો કરવા તે.
૧૧. યંત્રપીલનકર્મ : ઘંટી, ચરખા, ઘાણી અને મીલ ચલાવવી.
૧૨. નિર્લાંછનકર્મ : ઊંટ, બળદ, છોકરા, છોકરી વિગેરેનાં નાક-કાન વિંધવાં. તથા અંગચ્છેદ કરવો તે.
૧૩. દવદાનકર્મ : જંગલ, ઘર બાળવું, ક્યરો ભેગો કરી સળગાવવો ઘાસ કે વનસ્પતિ સળગાવવી.
૧૪. સરદ્રહતડાગશોષ : સરોવર, દ્રહ, તળાવ, કૂવા શોષવા, સુકવવા, ખાલી કરવા, એકનું પાણી બીજામાં નાખવું વિગેરે.
૧૫. અસતીપોષણ : કૂતરાં, બીલાડાં, વિગેરે હિંસક પ્રાણીઓને પાળવાં તથા દુરાચારી જીવનું પોષણ કરવું તે.

ઉપર કહેલાં ૩૨ અનંતકાય હું કાયમ માટે ત્યજી દઉં છું. ૨૨ અભક્ષ્ય પણ ત્યજું છું. અથવા ૧-૨-૩ અભક્ષ્ય વિના શેષને ત્યજી દઉં છું. દરરોજ સવારે અને સાંજે ચૌદ નિયમો ધારીશ. અને આ પંદર કર્માદાનોના વેપારોને છોડી દઈશ. જો આ પન્નરમાંના કોઈ એકાદ વેપાર વિના મારી આજીવિકા ચાલે તેમ નહીં હોય તો તેની જયણા. આવા નિયમવાળું આ સાતમું વ્રત હું પાળીશ. તથા નીચેના પાંચ અતિચારો (દોષો) નહીં લગાડું.

ન સેવવા યોગ્ય પાંચ અતિચારો

૧. સચિત્તઆહાર = જીવવાળી જે વસ્તુ તે સચિત્ત, તેનો આહાર કરવો તે, જેમકે દાડમ, લીંબુ, કેરી, કાચુ મીઠું, પપૈયુ, કાકડી, ટામેટાં, ભીંડા કાચુ પાણી વિગેરે.
૨. સચિત્તસંબદ્ધઆહાર = સચિત્તની સાથે સંબંધવાળુ ખાવું તે. જેમ કે બોર.
૩. સચિત્તસંમિશ્રઆહાર = સચિત્તથી મિશ્ર કરેલ આહારાદિ વાપરવો. જેમકે લીંબુના રસથી મિશ્ર કરેલાં દાળ-શાક વિગેરે.
૪. અભિષવઆહાર = વાસી આહાર, બોળ, અથાણું, વિગેરે ખાવું. મદિરા આદિ માદક પદાર્થોનો આહાર કરવો. વિવિધ પદાર્થોના મિશ્રણથી તૈયાર થયેલ મદિરા આદિ વિકારક પદાર્થોનું સેવન કરવું.
૫. દુષ્પવ્વઆહાર = બરાબર નહીં રંધાયેલો કાચો-પાકો આહાર ખાવો તે.

ઉપરના પાંચે અતિચારો ત્યજીને હું આ વ્રત પાળીશ.

૮. અનર્થદંડ વિરમણ પ્રત

(ત્રીજું ગુણપ્રત)

અનર્થ=બીનજરૂરી, આવશ્યકતા વિનાનું. દण्ड= પાપ, તેનું. વિરમણ=ત્યાગ.

જીવન જીવવામાં જે જે પાપો બિનજરૂરી છે. એટલે કે જે જે પાપો કરવાં આવશ્યક નથી. ન કરીએ તો પણ ચાલે તેમ છે. આનંદ ચમન, માન અને મોભા માટે જ જે પાપો કરાય છે તેવાં પાપોને અનર્થદંડ કહેવાય છે. તેવાં બિનજરૂરી પાપોથી અટકવું તેનો ત્યાગ કરવો અથવા પ્રમાણ કરવું તેને અનર્થદંડ વિરમણ પ્રત કહેવાય છે. આ પ્રત નીચેના નિયમોથી હું જીવનભર પાળીશ.

૧. આપઘાત, ખૂન અને સેક્સી વિચારો હું કરીશ નહીં અને તે પાપો કરવાના વિચારો આવશે તો સાચા હિતોપદેશકનું શરણું લઈશ.
૨. હું છૂટાછેડા લઈશ નહીં. આપીશ નહિ-અપાવીશ નહિ, આપવાની સલાહ આપીશ નહિ. તથા પુનર્લગ્નની પણ સલાહ આપીશ નહીં. લવમેરેજ, કોર્ટ લગ્ન, કુટુંબ નિયોજન તથા તેના સાધનોનો ઉપયોગ કરીશ નહિ-કરાવીશ નહિ અને તેમ કરવાની કોઈને સલાહ આપીશ નહિ.

૩. રાત્રિભોજન કરાય, બટાકા- ડુંગળી-લસણ વિગેરે કંદમૂલ ખવાય, M. C. માં બધાં જ કામો થાય. ઈત્યાદિ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ પાપકાર્યો કરવાનો ઉપદેશ આપીશ નહિ. અપાવીશ નહિ અને આવા વિરુદ્ધ ઉપદેશ આપનારને ચલાવી લઈશ નહિ. (સહન કરી લઈશ નહિ.)
૪. ઘણી હિંસાવાળા હિંસક ધંધાઓ કરવાનો ઉપદેશ, સલાહ કે શિખામણ આપીશ નહિ.
૫. લોટરીની ટીકીટ, પૈસાની શરતો, સટ્ટો, ગંજીપત્તાની રમત, જુગાર, પશુ-પક્ષીઓને લડાવવાં, મારવાં, શૂટ કરવાં, તથા તેવાં હિંસક કાર્યોની ટી. વી., વિડીઓ જોવી. મટકાના આંકડા લગાવવા. નવરાત્રિના ડીસ્કો દાંડીયારાસનું આયોજન કરવું. તથા જોવું, ગરબા, ડાન્સ, આ બધાં કાર્યો કરીશ નહિ. કરાવીશ નહિ અને જોઈશ પણ નહિ.
૬. હોળી-ધુળેટી વિગેરે પર્વોમાં રંગથી રમીશ નહિ. કોઈની ઠગા મશ્કરી-મજાક કરીશ નહિ. ફટાકડા ફોડીશ નહિ, વેચીશ નહિ, ઘરમાં હીરો અને હીરોઈનનાં કેલેન્ડર રાખીશ નહિ. બિભત્સ અને અર્ધનગ્ન ચિત્રો પાસે રાખીશ નહિ અને ઘરની દિવાલોમાં લગાવીશ નહિ.
૭. નાટક, સિનેમા, તમાસા, સરકસ, જીવનભર જોઈશ નહિ અથવા એક માસમાં.....થી વધારે જોઈશ નહિ.

૮. પતંગ ચગાવવાનું, ક્રિકેટ મેચ જોવાનું, ક્રિકેટ રમવાનું, કોમેન્ટ્રી સાંભળવાનું વિગેરે આ કાર્યો હું કરીશ નહિ. અથવા ૧ દિવસમાં.....કલાકોથી વધારે સમય તેમાં ગાળીશ નહિ.
૯. ઉપરના કાર્યોની (એટલે કે ક્રિકેટ મેચ વિગેરેની) શરત લગાવીશ નહિ. જુગાર ખેલીશ નહિ.
૧૦. ટી. વી., વીડીયો વસાવીશ નહિ અથવા કદાચ વસાવવું પડે તો પણ દેશના મુખ્ય મુખ્ય સમાચારો સિવાય જોઈશ નહિ-વગાડીશ નહિ. તથા કેબલ-ડીસ્કનું કનેક્શન લઈશ નહિ. તેનો વ્યવસાય કરીશ નહિ.
૧૧. કોઈ પાપકાર્ય થઈ જ ગયું હોય તો પાછળથી તેની પ્રશંસા કરીશ નહિ. પરંતુ તેનો પસ્તાવો કરી આલોચના લઈશ.
૧૨. કોઈ પુણ્યકાર્ય મેં કર્યું હોય તો પાછળથી તેનો પસ્તાવો કે નિંદાનું કાર્ય કરીશ નહિ. પરંતુ અનુમોદના કરીશ.
૧૩. કોઈની નિંદા, ઠકા, મશ્કરી, મજાક, કર્કશ વચનો બોલવાં. વ્યંગ-કટાક્ષ-મેણાં-ટોણાં બોલવાં. આવાં પાપો કરીશ નહિ.
૧૪. ગુસ્સો કરીશ નહિ. છતાં થઈ જાય તો.....રૂપિયા શુભ ખાતામાં વાપરીશ.
૧૫. દિવસે ઊંઘીશ નહિ. અથવા.....થી વધારે કલાક ઊંઘીશ નહિ.
૧૬. રાત્રે.....કલાકથી વધારે ઊંઘીશ નહિ.

૧૭. મ્યુઝીયમ જોવા જવું, કુકડાનું યુદ્ધ, મલ્લયુદ્ધ અને ઘોડાના રેસ જોવા જવું ઇત્યાદિ કાર્યો કરીશ નહિ. તથા તેની શરતો લગાવીશ નહિ.
૧૮. પર્વતિથિ, બે નવપદની ઓળી, પર્યુષણ પર્વ, ત્રણ ચોમાસીની અઢ્ઠાઈ ઇત્યાદિ મોટા દિવસમાં દળવાનું, ખાંડવાનું, પીસવાનું કે કપડાં ધોવાનું, સાબુથી સ્નાન કરવાનું ઇત્યાદિ કાર્યો કરીશ નહિ.
૧૯. શ્રાપ આપવાનું, હિંચોળે હિંચવાનું કાર્ય કરીશ નહિ.
૨૦. કોઈની પણ ખ્યાતિ સાંભળી અદેખાઈ કરીશ નહિ. માટી, મીઠું, અનાજ વિગેરે ઉપર પ્રયોજન વિના ચાલીશ નહિ. તેના ઉપર બેસીશ નહિ.
૨૧. જેના ઉપર રાગ હોય તેની આબાદી-ચડતી-ઋદ્ધિ ઇચ્છવાનું અને જેના ઉપર દ્વેષ હોય તેના મૃત્યુની, પડતીની અને નુકશાન થવાની ઇચ્છાઓ કરીશ નહિ.
- ઉપરના નિયમો યથાશક્તિ પાળવા પૂર્વક આ આઠમું વ્રત હું પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો)લગાડીશ નહિ.
- (૧) કંદર્પ : કામવાસના ઉત્તેજક વચનો બોલવાં, વાસનાવાળી વાણી બોલવી તથા મશ્કરી કરવી.
- (૨) કૌકુચ્ય : કામવાસના ઉત્તેજક આંખના મુખના અને શરીરના હાવભાવ કરવા. આંખ મેળવવી. ચુંબન કરવું, વાસના વર્ધક અંગો જોવાં.

- (૩) મૌખ્ય : વાચાળપણે ઘણું બોલવું. કોઈની પટ્ટી પાડવી.
- (૪) અસમીક્ષ્યાધિકરણ : વિચાર કર્યા વિના ચપ્પુ, છરી, ખાંડણીયો વિગેરે હિંસાનાં સાધનો વધારે વધારે ભેગાં કરવાં.
- (૫) ઉપભોગાધિકત્વ : શરીરની ટાપટીપ, શોભા શણગાર, ઘણાં કરવાં અને તેનાં સાધનો જરૂરિયાત કરતાં અધિક રાખવાં.
- ઉપરના અતિચારો (દોષો) લગાડ્યા વિના આ આઠમું વ્રત હું પાળીશ.

૯. સામાયિક વ્રત

(પહેલું શિક્ષાવ્રત)

સામાયિક = આત્માને સમભાવમાં લાવવો, તેના માટે કરાતું વ્રત.

હું દર મહિનામાં સામાયિક અને પ્રતિક્રમણ એમ બન્ને સાથે મળીને કુલ.....સામાયિક કરીશ. જો તે સંખ્યા તે માસમાં પૂરી ન થાય તો બાકી રહી ગયેલાં સામાયિકો તથા તેટલાં જ તેના દંડરૂપે અધિક સામાયિકો એમ બમણાં બીજા મહિનામાં રહી ગયેલા પેટે કરી આપવાં. આ સામાયિક વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ પાળીશ.

૧. દરેક સામાયિકમાં નવી ગાથાઓ ગોખીશ, અને જૂની ગાથાઓનો સ્વાધ્યાય કરીશ.
૨. વાઉકાય જીવોની રક્ષા માટે મુહપત્તિ અને ભૂમિ ઉપર હરતા-ફરતા જીવોની રક્ષા માટે કટાસણું અને ચરવાળાનો સારી રીતે ઉપયોગ કરીશ.
૩. ત્યાગ અને આર્ય સંસ્કૃતિ દર્શક ધોતી-ખેસ આદિ વેશ સામાયિકમાં રાખીશ. સ્ત્રીઓનો આશ્રયી સાડીનો વેશ ઈત્યાદિ સમજી લેવું.
૪. સામાયિકમાં સાંસારિક વાતો કરીશ નહિ, લેવા અને પાળવાનો સમય બરાબર ધ્યાનમાં રાખીશ. ભીંત વિગેરેનો ટેકો દઈશ નહિ.

૫૭

- પ. ઈલેક્ટ્રોનિક ઘડીયાળ સામાયિક કાળે પહેરીશ નહીં કે અડકીશ નહિ.
- દ. શરીર ઉપર ઘણો શણગાર કે ઘણા દાગીના પહેરીશ નહિ.
૭. સામાયિકમાં સમતાભાવ બરાબર રાખી સ્વાધ્યાય કરીશ અથવા સ્વાધ્યાય સાંભળીશ. પરંતુ નીચે મુજબના મનના-૧૦, વચનના-૧૦ અને કાયાના -૧૨ દોષો હું સેવીશ નહિ તથા પાંચ અતિયારો લગાડીશ નહિ.

મનના દશ દોષો : ૧. શત્રુને જોઈને તેના ઉપર દ્વેષ કરવો. ૨. અવિવેક ચિંતવવો. ૩. તત્ત્વનો વિચાર ન કરવો. ૪. મનમાં ઉદ્વેગ ધરવો. ૫. યશની ઈચ્છા કરવી. ૬. વિનય ન કરવો. ૭. ભય ચિંતવવો. ૮. વ્યાપાર ચિંતવવો. ૯. ફળની શંકા કરવી. ૧૦. નિયાણું કરવું. આ મનના ૧૦ દોષો જાણવા.

વચનના દશ દોષો : ૧. હલકાં વચનો બોલવાં, ૨. હુંકારા કરવા, ૩. પાપવાળાં કાર્યો કરવાનો આદેશ આપવો, ૪. લવારો કરવો, ૫. કજ્જ્યો કરવો, ૬. “કેમ છો ? મઝામાં છો ને?” આ પ્રમાણે ક્ષેમકુશળ પૂછી આગતા-સ્વાગતા કરવી. ૭. ગાળ દેવી. ૮. બાળક રમાડવું, ૯. વિકથા કરવી, ૧૦. હાંસી કરવી. (મશકરી કરવી.) આ વચનના ૧૦ દોષો જાણવા.

કાયાના બાર દોષો : ૧. આસન વારંવાર ફેરવવું, ૨. ચોતરફ જોયા કરવું, ૩. સાવધ (પાપવાળું) કાર્ય કરવું,

૫૮

૪. આળસ મરડવી, ૫. અવિનયે બેસવું, ૬. ભીંતનું ઓઠીગણ લઈને બેસવું, ૭. શરીર ઉપરનો મેલ ઉતારવો, ૮. ખણજ ખણવી, ૯. પગ ઉપર પગ ચઢાવવો, ૧૦. કામવાસનાને કારણે બીજા લોકો દેખે તે રીતે અંગો ઉઘાડાં રાખવાં, ૧૧. જંતુઓના ઉપદ્રવથી ડરીને અંગો ઢાંકી રાખવાં, ૧૨. નિદ્રા લેવી. આ કાયાના બાર દોષો જાણવા.

ન સેવવા યોગ્ય પાંચ અતિયારો

૧. **મનદુષ્પ્રણિધાન** = મનમાં ખોટા અને અનુચિત વિચારો કરવા તે.
૨. **વચનદુષ્પ્રણિધાન** = વચનમાં ખોટાં, હલકાં અને કષાય ભરેલાં વચનો બોલવાં તે.
૩. **કાયદુષ્પ્રણિધાન** = કાયાથી કુચેષ્ટા કરવી, અનુચિત આચરણ કરવું.
૪. **અનાદર** = સામાયિકમાં ગુરુ અને સ્થાપનાચાર્ય આદિનો અનાદર કરવો. ઉંચા આસને બેસવું, લાંબા પગ રાખવાં, પગ ઉપર પગ ચઢાવવા વિગેરે.
૫. **સ્મૃતિઅનુપસ્થાપન** = સામાયિકનો સમય યાદ ન રાખવો, ભૂલી જવો.

ઉપરોક્ત પાંચે અતિયારો અને મન-વચન-કાયાના બત્રીસે દોષોથી રહિત એવું આ સામાયિક વ્રત હું પાળીશ.



૧૦. દેશાવગાસિક પ્રત (બીજું શિક્ષાપ્રત)

દેશ = ક્ષેત્રનું, અવગાસ = માપ ધારવું, ક્ષેત્રના માપની ધારણાને દેશાવગાસિક કહેવાય.

આખા વર્ષમાં.....દેશાવગાસિક પ્રત કરીશ. હું જે દિવસે દેશાવગાસિક પ્રત કરું તે દિવસે દેરાસર અને ઉપાશ્રયે જવાના કાર્ય વિના ઘરની બહાર ક્યાંય જવું નહિ. દુનિયાથી દૂર થઈ જવું, સ્વાધ્યાયમાં અને આત્મ તત્વના ચિંતનમાં લીન થઈ જવું. બહાર જવાની ભૂમિ સંક્ષેપવી, હરવા-ફરવા માટેનું ક્ષેત્ર અત્યન્ત સંક્ષેપવું, તે દેશાવગાસિક પ્રત કહેવાય છે. ઘણા લોકો બે પ્રતિક્રમણ અને આઠ સામાયિકને દેશાવગાસિક કહે છે. પરંતુ તે બરાબર નથી. “દુનિયાથી અલિપ્ત થવા માટે દેશ=દિશાને-ક્ષેત્રને, અવગાસિક =માપ ધારીને ટુંકાવવું એ જ સાચું પ્રત છે.” તેના પાંચ અતિચારો પણ આ અર્થને અનુસારે છે. ફક્ત સ્વીકારેલા ઉપરોક્ત પ્રતને (દિશાના નિયમને) પાળવા માટે તેના ઉપાયરૂપે બે પ્રતિક્રમણ, આઠ સામાયિક અને એકાસણાનું તપ કરવાનું છે. દિશાનો સંક્ષેપ ધારવો તે પ્રત અને સામાયિક પ્રતિક્રમણ કરવાં તે આ પ્રત પાળવાના ઉપાયો છે.

આ દેશાવગાસિક પ્રત પાળતાં હું નીચેના નિયમો પાળીશ.

૧. આ પ્રતમાં ફોન લઈશ નહિ અને ફોન કરીશ નહિ.
૨. આ પ્રતમાં ટપાલ બહાર મોકલીશ નહિ અને બહારથી આવેલ ટપાલ વાંચીશ નહિ તથા છાપાં વાંચીશ નહિ.
૩. કોમ્પ્યુટર દ્વારા દેશ-વિદેશના સમાચારો આ પ્રત કાલે લઈશ નહિ, કોમ્પ્યુટર ચલાવીશ નહિ.
૪. પ્રત કાળે તેને બરાબર પાળવા માટે એકાસણાનું તપ, બે (સવાર-સાંજ) પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરીશ.
૫. આ પ્રતના દિવસે નિરંતર સ્વાધ્યાય કરીશ, ગાથાઓ ગોખીશ, અધ્યાત્મના ગ્રંથો વાંચીશ અને વૈરાગ્યવર્ધક તત્ત્વચિંતન અને અનિત્યાદિ ભાવનાઓ ભાવીશ.
૬. ઘરના સભ્યો સાથે પણ ધર્મચર્યા વિના બીજો કોઈપણ વાર્તાલાપ તે દિવસે કરીશ નહિ.

આ પ્રત પાળવામાં નીચેના પાંચ અતિચારો (દોષો) હું લગાડીશ નહિ.

૧. આનયનપ્રયોગ : નિયમિતપણે ધારેલા ક્ષેત્રના પ્રમાણના બહારની ભૂમિથી અંદર કંઈ મંગાવવું તે.
૨. પ્રેધ્યપ્રયોગ : ધારેલા ક્ષેત્રના પ્રમાણની અંદરથી કોઈ પણ વસ્તુ ક્ષેત્ર પ્રમાણથી બહાર મોકલવી તે.
૩. શબ્દાનુપાત : ખોંખારો, ઉધરસ, છીંક, ખાઈને અથવા તાળી આદિ પાડીને શબ્દ કરવા દ્વારા ધારેલી ભૂમિથી બહાર ઉભેલી વ્યક્તિનું ધ્યાન પોતાના તરફ દોરવું. અંદર બોલાવવો તે.

૪. **રૂપાનુપાત** : બારીમાંથી, અગાસીમાંથી આપણું મુખ બહાર કાઢી ધારેલી ભૂમિથી બહાર ઉભેલા માણસને મુખ દેખાડવા દ્વારા તેનું ધ્યાન દોરવું તે.
૫. **પુદ્ગલપ્રક્ષેપ** : ધારેલી ભૂમિથી બહાર ઉભેલી વ્યક્તિ ઉપર પત્થર-કાંકરો અથવા બીજી કોઈ ચીજ નાખીને તે વ્યક્તિનું ધ્યાન દોરવું અને ઈશારાથી અંદર બોલાવવો તથા કાચ વડે સૂર્યનો પ્રકાશ બહારની વ્યક્તિ ઉપર નાંખવો વિગેરે.

આ પાંચ અતિચાર દોષ લગાડ્યા વિના હું આ દેશાવગાસિકવ્રત પાળીશ.

૧૧. પૌષધોપવાસ વ્રત (ત્રીજું શિક્ષાવ્રત)

પૌષધ = ધર્મની પુષ્ટિ કરે, વૃદ્ધિ કરે તે, **ઉપવાસવ્રત**
= ઉપવાસપૂર્વકનું વ્રત.

આખો દિવસ, આખી રાત્રિ, અથવા આખો દિવસ અને રાત્રિમાં સાધુના જેવું જીવન જીવવું. સાવધ (પાપવાળું) કાર્ય કરવું નહિ, સામાયિકનાં વસ્ત્રો પહેરી સામાયિક લેવાની વિધિ પ્રમાણે પૌષધ અને સામાયિક ઉચ્ચરીને આખો દિવસ (તેમાં કહેલી વિધિ પ્રમાણેની) ધર્મક્રિયામાં અને સ્વાધ્યાય-તત્ત્વચિંતન-મનન-વ્યાખ્યાન શ્રવણ ઇત્યાદિ ધર્મકાર્યોમાં સમય વ્યતીત કરવો. સચિત્તદ્રવ્યનો અને વિજાતીય વ્યક્તિનો સ્પર્શ પણ સર્વથા કરવો નહિ. સંસારનો જાણે સર્વથા ત્યાગ કર્યો હોય તેમ તે દિવસ જ્ઞાન-ધ્યાન-તપ અને આરાધના સાધનામાં પસાર કરવો. તે પૌષધોપવાસ વ્રત.

આવા પ્રકારનું પૌષધોપવાસ વ્રત વર્ષમાં.....કરીશ.

આ વ્રત પાળવામાં હું નીચેના નિયમોને આધીન રહીશ.

૧. પૌષધવ્રતમાં સચિત્ત વસ્તુનો અને વિજાતીય વ્યક્તિનો સ્પર્શ કરીશ નહિ.

૬૩

૨. પર્વતિથિઓ, બે આઠમ, બે ચૌદસ, સુદ પાંચમ વિગેરે દિવસોમાં તથા સંવચ્છરીના દિવસે, અથવા પર્યુષણના આઠ દિવસોમાં હું યથાશક્તિ પૌષધ વ્રત કરીશ.
૩. પૌષધ મોડો લેવાનું અને વહેલો પાળવાનું કામ કરીશ નહિ.
૪. પૌષધમાં પારણાની ચિંતા-વિચારણા કરીશ નહિ.
૫. પૌષધમાં જ્યાં-જ્યાં બેસવાનું, ઉભા રહેવાનું કે સંથારો કરવાનું હશે ત્યાં ત્યાં ભૂમિને બરાબર જોઈને તથા બરાબર પૂજીને જ કરીશ.
૬. મલ-મૂત્ર પણ ભૂમિને બરાબર જોઈને તથા બરાબર પૂજીને જ કરીશ.
૭. સમયસર દેવવંદન-પડિલેહણ-પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરીશ. અને તે સંપૂર્ણ સાવધાનીથી કરીશ.
૮. દિવસે ઉંઘવાનું કે આડા પડવાનું કે વિકથા આદિ કરવાનું કાર્ય કરીશ નહિ.
૯. નિરંતર ધર્મક્રિયા, વ્યાખ્યાન શ્રવણ તથા અધ્યાત્મશાસ્ત્રોનો સ્વાધ્યાય આદિ આરાધનાના કાર્યો કરીશ.

નીચે મુજબના પાંચ અતિચાર દોષો આ વ્રતમાં લગાડીશ નહિ.

૬૪

૧. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત ઉત્સર્ગ : ભૂમિ જોયા વિના અને પૂંજ્યા વિના મલ-મૂત્ર પરઠવવાં. સંડાસ-બાથરૂમનો ઉપયોગ કરવો.
૨. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત આદાનનિક્ષેપ : ભૂમિ જોયા વિના અને પૂંજ્યા વિના વસ્ત્રો-પાત્રો વિગેરે સર્વ વસ્તુઓ લેવી અને મૂકવી.
૩. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત સંસ્તાર ઉપક્રમણ : ભૂમિ જોયા વિના અને પૂંજ્યા વિના આસન-શયન-બેઠક કરવી. સંથારો પાથરવો તે.
૪. અનાદર : પૌષધવ્રતમાં દેવ-ગુરુ અને ધર્મનો અનાદર કરવો. આદર-બહુમાન ન કરવાં. વિવેક ન જાળવવો તે.
૫. સ્મૃતિઅનુપસ્થાપન : પૌષધ મોડો લેવો. વહેલો પાળવો. પૌષધ જ્યારે લીધો હોય ત્યારનો સમય ભૂલી જવો.

ઉપરના અતિચાર દોષો લગાડ્યા વિના આ પૌષધવ્રત હું પાળીશ. વર્ષમાં.....પૌષધ કરીશ. જો તે સંખ્યા પ્રમાણે તે વર્ષમાં પૌષધ નહિ થાય તો બીજા વર્ષે તેના બદલામાં બાકી રહેલી સંખ્યાથી બમણા કરીશ. અને બીજા વર્ષના જુદા કરીશ. જો ધારેલી પૌષધની આ સંખ્યા નહિ પુરાય તો તેના દંડરૂપેરૂપીયા ઉત્તમ કાર્યોમાં ખર્ચાશ.



૧૨. અતિથિસંવિભાગ વ્રત (ચોથું શિક્ષાવ્રત)

અતિથિ=તિથિ જોઈને આવે એવો નિયમ નહીં. અર્થાત્ વિહાર કરતા કરતા અચાનક પધારે તે **અતિથિ** એટલે પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સા. આદિ. **સંવિભાગ**=ભક્તિ કરવી તે બારમું વ્રત.

આ વ્રત કરનારને દિવસ અને રાત્રિનો પૌષધ કરવાનો હોય છે. ચઉવિહાર (ન બની શકે તો તિવિહાર) ઉપવાસ કરવાનો હોય છે. પારણામાં એકાસણું કરવાનું હોય છે. પારણાના પ્રસંગે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને વહોરાવીને (ભક્તિ કરીને) જ પારણું કરવાનું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીની જે વસ્તુ વહોરવાથી ભક્તિ થઈ, તે જ વસ્તુ પારણામાં વાપરવાની છે. જેનાથી ભક્તિ થઈ શકી નથી તે વસ્તુ વાપરવાની નથી. આવું જે આ વ્રત તે **અતિથિસંવિભાગ વ્રત** કહેવાય છે.

આખા વર્ષમાં ૧-૨ અથવા.....અતિથિ સંવિભાગ વ્રત હું કરીશ. જો તે વર્ષમાં તે સંખ્યા પ્રમાણે ન થાય તો રહી ગયેલી સંખ્યા પ્રમાણે દંડ સાથે બીજા વર્ષમાં બમણા કરી આપીશ. અને બીજા વર્ષના અતિથિ સંવિભાગની સંખ્યા પણ જુદી ગણીને કરીશ. જો કોઈ કારણે નિયત સંખ્યા પ્રમાણે અતિથિ-સંવિભાગ નહિ જ થાય તો છેલ્લે.....રૂપિયા ઉત્તમ

કાર્યોમાં વાપરીશ. જો પારણાના પ્રસંગે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનો યોગ ન જ મળી શકે તો વ્રતધારી કોઈ ઉત્તમ શ્રાવક-શ્રાવિકાને જમાડીને (ભક્તિ કરીને) એકાસણું કરીશ. આ વ્રત પાળવામાં હું નીચેના નિયમો બરાબર સાચવીશ.

૧. પારણાના પ્રસંગે પૂ. મહારાજશ્રીને બહુમાનપૂર્વક ઘરે લાવીશ અને બહુમાનપૂર્વક વહોરાવીશ.
૨. એક મહારાજશ્રી વહોરી ગયા પછી બીજા મહારાજશ્રી પધારશે તો પણ ભાવપૂર્વક વહોરાવીશ.
૩. તેઓશ્રી જે વસ્તુ વહોરશે. તે વસ્તુનો જ હું આહાર કરીશ.
૪. પૌષધના કાળે પારણાની ચિંતા નહીં કરું.
૫. પૌષધ પાળ્યા પછી અને પારણા પહેલાં જિનેશ્વર પ્રભુની ભક્તિ-સેવા ભાવપૂર્વક કરીને પછી ગુરુજીને વહોરાવીને એકાસણું (પારણું) કરીશ. આ વ્રતના નીચે મુજબ પાંચ અતિચારો લગાડીશ નહિ.

ન સેવવા યોગ્ય બારમા વ્રતના પાંચ અતિચારો

૧. **સચિત્તનિક્ષેપ** : વહોરાવવા યોગ્ય નિર્દોષ વસ્તુને ન વહોરાવવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ ઉપર મૂકવી તે.
૨. **સચિત્તપિધાન** : વહોરવવા યોગ્ય વસ્તુને ન આપવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ વડે ઢાંકી દેવી તે.

૬૭

૩. પરવ્યપદેશ : પોતાની વસ્તુને ન વહોરાવવાની બુદ્ધિથી પારકી કહેવી, અને પારકી વસ્તુને પોતાની કહીને વહોરાવી દેવી તે.
૪. માત્સર્ય : ઈર્ષ્યા, મનમાં દાઝ, અન્તર્દ્વેષ રાખીને વહોરાવવું.
૫. કાલાતિક્રમ : વહોરાવવાનો કાળ વીતી ગયા પછી બોલાવવા જવું.

આ પાંચ અતિયારો લગાડ્યા વિના આ બારમું અતિથિસંવિભાગ વ્રત હું પાળીશ.

બારવ્રતના અંતે સંલેખના વ્રત

સંલેખના = ટૂંકાવવું. સંસારની ઈચ્છાઓને ટૂંકાવવી. વ્રતોમાં રાખેલી છૂટછાટને ટૂંકાવવી. આહારાદિનો ત્યાગ કરવો.

મૃત્યુકાળ નજીક જણાય ત્યારે પાપોના આશ્રવને ઘટાડવા માટે વ્રતોમાં રાખેલી વિશાળ છૂટછાટને ટૂંકાવવી. અશનાદિ ચાર પ્રકારના આહારોમાંથી યથાશક્તિ ત્યાગ કરવો. ભોગસુખો અને સાંસારિક પરિસ્થિતિઓને ત્યજી દેવી અથવા તે સુખોની મમતા (ઈચ્છા) ત્યજી દેવી. વ્રતોમાં રાખેલી છુટોને પણ દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી ટૂંકાવી દેવી તે સંલેખના.

આ વ્રતના કાળે નીચેના પાંચ અતિયારો લગાડીશ નહિ. બારે વ્રતોની છૂટછાટને ટૂંકાવવા રૂપ આ સંલેખના વ્રત એ જુદું વ્રત નથી પરંતુ બારે વ્રતના સમૂહરૂપ છે.

૬૮

ન સેવવા યોગ્ય પાંચ અતિયારો

૧. ઈહલોક : ધર્મના પ્રભાવે આ ભવમાં સુખો ઈચ્છવાં તે.
 ૨. પરલોક : ધર્મના પ્રભાવથી પરભવમાં ઈન્દ્ર-દેવ-રાજા અને ચક્રવર્તીપિણાનાં સુખો ઈચ્છવાં તે.
 ૩. જીવિતાશંસા : સુખ આવે ત્યારે લાંબુ જીવન ઈચ્છવું.
 ૪. મરણાશંસા : દુઃખ આવે ત્યારે મરણ ઈચ્છવું.
 ૫. આશંસાપ્રયોગ : કામભોગના સુખોની (તીવ્ર) ઈચ્છાઓ કરવી.
- આ પાંચ અતિયાર દોષ લગાડ્યા વિના હું સંલેખના કરીશ.

આ પ્રમાણે સમ્યક્ત્વ સહિત બાર વ્રતો અને પંચાચારનું હું જીવનભર પાલન કરીશ. કોઈ દોષ લગાડીશ નહિ. અને જો કોઈ દોષ લાગી જાય તો ગુરુજી પાસે પ્રાયશ્ચિત્ત લઈશ.

બારે વ્રતોના મળીને ૧૨૪ અતિયારો સેવીશ નહિ.

જ્ઞાનાચારના	૮	સમ્યક્ત્વવ્રતના	૫	સ્થાનકવાસી સંપ્રદાયમાં બારવ્રતોના ૬૦ અને પંચાચારના ૩૯ કુલ ૯૯ અતિયાર હોય છે.
દર્શનાચારના	૮	બાર વ્રતોના	૬૦	
ચારિત્રાચારના	૮	સંલેખનાના	૫	
તપાચારના	૧૨	કર્માદાનના	૧૫	
વીર્યાચારના	૩			
૩૯		+	૮૫=૧૨૪	

૭૧

૧૭. M. C.ના સમયમાં રસોઈ કરવાનું કામ, સંતોને વહોરાવવાનું કામ, મંદિરે જવાનું અને દર્શન-પૂજનાદિનું કામ, પુસ્તકો વાંચવાનું કે સ્પર્શ કરવાનું કામ ઇત્યાદિ કરીશ નહિ. શાસ્ત્રની આજ્ઞાને બરાબર પાળીશ.
૧૮. જૈન તરીકે ન છાજે (ન શોભે) તેવાં કાર્યો જેમ કે કતલખાનાં કરવાં કે મત્સ્યોદ્યોગ કરવો. ઇત્યાદિ પાપધંધા કરીશ નહિ.
૧૯. પ્રતિવર્ષમાં ૧ તીર્થયાત્રા કરીશ. કુટુંબને કરાવીશ.
૨૦. હું મારા કુટુંબને શક્ય બની શકશે તેટલું ધર્મ-સંસ્કારોથી પરિચિત રાખીશ.
૨૧. કમાણીનો.....અમુક હિસ્સો પરોપકારના કાર્યોમાં વાપરીશ.
૨૨. દિવસમાં ઘરનાં કામકાજ અને ધંધાના કામકાજ કરતાં બાકી બચતા સમયમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીશ.
૨૩. સંઘ અને સમાજનાં કાર્યોમાં સાથ-સહકાર આપીશ. વિરોધ અને વાંધા-વચકા નાંખીશ નહિ. ખોટું કરનારને સમજાવીશ.
૨૪. આડોશ-પાડોશની સાથે અને પરિચિત વ્યક્તિઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ. કલેશ અને કડવાશ કરીશ નહિ.
૨૫. ઉપરોક્ત નિયમોવાળી આ મારી બુક દરરોજ એકવાર અવશ્ય વાંચીશ.

૭૨